

Super Visa/ Visitor to Canada Insurance

Best Mortgage Rates  
1st and 2nd Mortgages  
Life and Critical Illness Insurance  
RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth  
Financial Advisor  
www.pyramidfinancial.ca  
Serving at 2 locations  
GTA East / GTA West ON LIC # 10530  
Investment | Insurance | Mortgages

परदेशां देशी महेंक अटले

**स्वदेश**

केनेडाथी प्रसिद्ध थतुं सर्वोत्तम गुजराती साप्ताहिक SWADESH

FOR BUYING, SELLING & LEASING  
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS  
Free Home Staging Consultation  
Professional Photography & Virtual Tour  
Attractive Advertising  
Social Media Marketing  
Customized Feature Sheet  
Weekly Open House  
Assist in Mortgage & Legal Services

FOR BUYERS  
Team of Strong Mortgage Brokers  
Team of Lawyers  
Professional Home Inspectors  
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH Sales Representative  
Dir: 647-995-5640  
amit@homekey236@gmail.com

KOMAL SHAH Sales Representative  
Dir: 647-624-5640  
komal@homekey236@gmail.com

Homekey236@gmail.com  
Web: www.amitshah.ca

FRIDAY, 03 JUNE, 2022 Vol. 19, No. 22 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

# જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો દોર : 26 દિવસમાં 8 લોકોની હત્યા થી ભયનો માહોલ

## કાશ્મીરમાં બેંક મેનેજર સહિત 2 હિન્દુની હત્યા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ સાથે તાબડતોબ બેઠક યોજી આવશ્યક પગલા લેવા આદેશ આપ્યો

### જમ્મુ કાશ્મીર

ગુરુવારે આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. અન્ય એક ઘટનામાં બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મગરેપોરામાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ફાયરિંગ કરતા એકનું મોત થયું હતું. રાજસ્થાનના વિજયકુમાર કુલગામના મોહનપોરામાં અરેહ મોહનપોરા બેંકમાં ફરજ બજાવતા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યાં મુજબ આતંકવાદી આજે ગ્રાહકના વેશમાં બેંકમાં ઘૂસ્યો હતો જે પછી તેણે આમતેમ નજર ફેરવીને તક મળતા જ બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું અને પછી ભાગી ગયો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત વિજયકુમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય એક ઘટના મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મગરેપોરામાં બની હતી. અહીં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો ઉપર ફાયરિંગ કર્યું હતું. તેથી એક મજૂરના હાથમાં ગોળી વાગી હતી અને બીજા મજૂરના હાથ ખભા પર ગોળી વાગી છે. ઈજાગ્રસ્ત અવસ્થામાં બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બિહાર નિવાસી દિલખુશને એસએમએચ હોસ્પિટલ પહોંચતાં મૃત જાહેર કરાયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત એક મજૂરનું નામ ગોરિયા છે, મે મહિનામાં બીજા કાશ્મીરી પંડિતની આતંકીઓ દ્વારા હત્યા થઈ છે. જેને પગલે ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોએ સામૂહિક હિજરતની ચીમકી આપી છે. ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને અન્ય સાથે જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી સુરક્ષા માટે આવશ્યક પગલા લેવા સુચના આપી હતી.



26 દિવસમાં ૪ 8 હત્યા

7મી મે: શ્રીનગરનાં આઈવા બ્રિજ પાસે પોલીસ કોન્સ્ટેબલ ગુલામ હસન ડારની ગોળી મારીને હત્યા.  
12મી મે: બડગામમાં સરકારી ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ મહેસૂલી અધિકારી રાહુલ ભટ્ટની ગોળી મારીને હત્યા કરી હતી. રાહુલ ભટ્ટ કાશ્મીરી પંડિત હતા.  
13મી મે: પુલવામાં જમ્મુ-કાશ્મીરના પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ ઠોકરની તેના ઘર પાસે ૪ ગોળી મારીને હત્યા.  
17મી મે: બારામૂલાનાં દીવાન બાગ વિસ્તારમાં વાઈન શોપ પર આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરાયો જેમાં 52 વર્ષનાં રંજિતસિંહનું મોત થયું હતું. ૩ને ઈજા થઈ હતી.  
24મી મે: પોલીસકર્મચારી સૈફુદ્દીન ચૌધરીની ગોળી મારીને હત્યા. જેમાં તેની 7 વર્ષની પુત્રીને ઈજા થઈ હતી.  
25મી મે: લશ્કર-એ-તોયબાના ૩ આતંકીઓએ ઘરમાં ઘૂસી એક્ટ્રેસ અમરીન ભટ્ટની ગોળી મારી હત્યા કરી.  
31મી મે: કુલગામમાં ગોપાલપુરમાં આતંકીઓ દ્વારા હિન્દુ શિક્ષિકા રવજીબાબાની હત્યા કરી હતી.  
2 જૂન: કુલગામમાં હિન્દુ બેન્ક મેનેજર વિજયકુમારની ગોળી મારીને હત્યા કરાઈ હતી.

## યુએસના ઓક્લાહોમામાં હોસ્પિટલમાં ફાયરિંગથી 4 મોત, હુમલાખોર પણ ઠાર



ઓક્લાહો

અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલો ઓક્લાહોમાના તુલસા સિટીમાં સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ પરિસરમાં નતાલી બિલ્ડિંગમાં થયો છે. તુલસા પોલીસના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા હુમલાખોરે ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારે પોલીસે ઘટનાસ્થળે જઈ હુમલાખોરને ઠાર માર્યો હતો. અમેરિકામાં આર્મ્સ લાયસન્સ કાયદાના કારણે અવારનવાર ગોળીબારની ઘટનાઓ સામે આવે છે, જેમાં નિર્દોષ લોકો માર્યા જાય છે. 24 મેના રોજ, ઉવાલ્ડેની પ્રાથમિક શાળામાં ગોળીબારમાં 19 બાળકો સહિત 23 લોકો માર્યા ગયા હતા. આ અંગે ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે હવે આ દિશામાં પગલા ભરવાનો સમય આવી ગયો છે. રાષ્ટ્રપતિ જો બિડેને પણ તુલસા હોસ્પિટલ સંકુલમાં ગોળીબારની જાણ કરવામાં આવી હતી. બુધવારે સ્થાનિક સમય અનુસાર વ્હાઈટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તુલસા પોલીસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે એક અજાણ્યા રાઈફલમેન નતાલી બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા.

## હિન્દુ કર્મચારીઓને વિશેષ સુવિધા અને સુરક્ષા અપાશે

ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે પ્રદેશના એલજી મનોજ સિન્હાએ બુધવારે અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. પીએમ પેકેજ હેઠળ સરકારી નોકરી કરવા માટે કાશ્મીર ઘાટીમાં પાછા ફરેલા હિન્દુઓને ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે તેમની તૈનાતી હવે જિલ્લા મુખ્યાલયો પર કરાશે. અહીં તે કર્મચારીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરાશે. આ સાથે જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને એકદમ ફૂલપૂરું સુરક્ષા વ્યવસ્થા અપાશે. આવા હિન્દુ કર્મચારીઓને હવે તસહીલો કે રિમોટ એરિયાની ડ્યૂટીમાંથી હટાવી દેવાશે. કાશ્મીરી હિન્દુઓને જમ્મુ રિલોકેટ કરવાની માંગણી સ્વીકારાશે નહીં.

**SUPER VISA & INSURANCE**

Get Full REFUND if visa is declined  
Get partial refund if parents leave early\*  
\*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri  
Insurance Broker  
Ph.: 416-890-3232  
Email: sanjivpuri@rogers.com

StarLife  
Insurance & Investments Inc.  
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE  
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

**Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬**

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

**www.ashoktravel.com**  
Ashok Travels Serving your travel needs in Canada since 1973  
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Residential  
New Condos  
Investments  
Commercial

દુરામાં રાઈ સખરો  
**Zakir Patel**  
Broker  
Cell: 416-561-7973  
Office: 416-287-2222

RE/MAX  
COMMUNITY  
Realty Inc., Brokerage

Independently Owned and Operated  
1265, Morningside Ave. #203  
Toronto, ON M1B 3V9  
Email: patelzakir82@gmail.com

**SS & LAWYERS LLP**

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

**Avni Shah**  
B.A., JD  
Barrister & Solicitor

ashah@sslawyers.ca  
Tel : 416-818-4000  
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

# કેનેડામાં હેન્ડગન ઉપર પ્રતિબંધ લાદવા પ્રસ્તાવ

મિલિટરી ગ્રેડનાં હથિયારો પરત લેવાશે: હથિયારોની ક્ષમતા પણ મર્યાદિત કરાશે, હથિયાર વેચાણ અને ખરીદી અંગેના નિયમો જાહેર

ટોરોન્ટો

અમેરિકામાં ટેકસાસના ઉવાલ્ડેમાં ફાઈરિંગમાં 19 બાળક અને 2 શિક્ષકની હત્યા બાદ ગન કલ્ચર કાબૂમાં લેવા મુદ્દે અમેરિકામાં ચર્ચા છેડાઈ છે. ત્યારે તેનો પાડોશી દેશ કેનેડા એક ડગલું આગળ વધ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગન કંટ્રોલ માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે અંતર્ગત લોકોએ ખતરનાક તથા મિલિટરી ગ્રેડનાં હથિયારો બાયબેક પ્રોગ્રામ અંતર્ગત બદલાવવાના રહેશે. આ પ્રસ્તાવ દ્વારા સરકાર હથિયારોની ક્ષમતા પણ

## ફાયરિંગના વધેલા બનાવો સરકારના નિર્ણય પાછળનું કારણ

કેનેડામાં હેન્ડગનના વેચાણ-ઉપયોગ પર રોકના પ્રસ્તાવનું મોટું કારણ એ છે કે ફાયરિંગના 60% બનાવોમાં તેનો ઉપયોગ હોવાનું જણાયું છે. કેનેડામાં દર ત્રીજા માણસ પાસે ગન છે. સ્વિટ્ઝર્લેન્ડની NGO 'ધ સ્મોલ આર્મ્સ'ના સરવે મુજબ 3.8 કરોડની વસતીવાળા કેનેડાના લોકો પાસે 2017 સુધીમાં કાયદેસર-ગેરકાયદે મળીને કુલ 1.27 કરોડ ગન હતી. એટલે કે દર 100 લોકો દીઠ 35 હથિયાર હતા. અંદાજે 33 કરોડની વસતીવાળા અમેરિકામાં 30 કરોડથી વધુ હથિયારો ચલણમાં છે.

મર્યાદિત કરશે અને ગન જેવાં દેખાતાં રમકડાં વ્યક્તિને ટ્રાન્સફર કરવા માટેના નિયમો પણ ઉપર પણ પ્રતિબંધ લાદશે. આ સાથે જ સરકારે જાહેર કર્યા છે. ટ્રુડોએ કહ્યું હતું કે, નવા ઉપાય જરૂરી હતા. કેમ કે, બંદૂક હિંસા વધી રહી છે.

આપણે દેશમાં હેન્ડગન મર્યાદિત કરવી જ પડશે. હેન્ડગનના વેચાણ ઉપર રોકનો પ્રસ્તાવ 2020માં નોવા સ્કોશિયામાં ફાઈરિંગમાં 22 લોકોની હત્યા બાદ હિંસા રોકવા લેવાયેલાં પગલાંની કડીમાં નવો છે. નોવા સ્કોશિયાની ઘટના બાદ ટ્રુડો સરકારે મિલિટરી ગ્રેડની સેમીઓટોમેટિક એઆર-15 સહિતની રાઈફલ્સના 1500 મોડલ પર રોક લગાવી હતી. કેનેડાના જાહેર સુરક્ષામંત્રી માર્કો મેન્ડિસિનોએ કહ્યું હતું કે, બાયબેક ચાલુ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે.

## પીક-શુએન ફુંગનાં પુસ્તકને મળ્યો એમેઝોન કેનેડા ફર્સ્ટ નોવેલ એવોર્ડ

ફુંગને "ઘોસ્ટ ફોરેસ્ટ" માટે \$ 60,000નું ઈનામ આપવામાં આવ્યું

ટોરોન્ટો

વાનકુવરમાં ઉછરેલા લેખક પીક-શુએન ફુંગે આ વર્ષનો એમેઝોન કેનેડા ફર્સ્ટ નોવેલ એવોર્ડ જીતી લીધો છે. બુધવારના રોજ ટોરોન્ટોમાં એક સમારોહમાં ફુંગને "ઘોસ્ટ ફોરેસ્ટ" માટે \$ 60,000નું ઈનામ આપવામાં આવ્યું હતું.

પ્રકાશક સ્ટ્રેન્જ લાઈટનું શીર્ષક તેના

પિતાના મૃત્યુ સાથે ઝઝૂમી રહેલા અનામી નાયકની વાર્તાને અનુસરે છે. ફુંગનો જન્મ હોંગકોંગમાં થયો હતો અને તેનો ઉછેર વાનકુવરમાં થયો હતો, પરંતુ તે હવે ન્યૂયોર્ક શહેરમાં રહે છે.

1976માં શરૂ થયેલ, પ્રથમ નવલકથા પુસ્તકારના અગાઉના વિજેતાઓમાં માર્કલ ઓન્ડાલ્જે, ડબલ્યુ. પી. કિન્સેલા, નીનો રિક્કી, ડેવિડ બેઝમોઝગીસ, આન્દ્રે એલેક્સિસ અને મેરેલીન થિએનનો સમાવેશ થાય છે. ઈનામ એમેઝોન અને ધ વોલરસ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે.



## ઓન્ટેરિયોમાં ચૂંટણી અને વચનોની લહાણી

અનેક પાર્ટીના નેતાઓએ લોકોને જીવનધોરણ સુધારવા અને આવક વધારવા વચનો આપ્યા

ટોરોન્ટો

ઓન્ટેરિયોની ચૂંટણીમાં લગભગ દરેક ઉમેદવારે લોકોની પોષણક્ષમતાની વાતો કરી છે. લોકોના જીવનધોરણને અનુરૂપ આવકના વચનો આપ્યા હતા અને લોકોની આવક વધારવાની પણ ખાતરી આપી હતી. તેમના પક્ષો તરફથી ઘણી બધી રાહતો અને વળતરની પણ વાત કરી છે. ખાસ કરીને ટેકઆઉટ ખાણ પરના સેલ્સટેક્ષ ઘટાડવાની વાત મુકી હતી. જે મતદારોને ગુંચવી નાંખે એવી હતી.

આ વાતો સાંભળવામાં સારી હતી પણ એનો અમલ થશે કે કેમ એવો સવાલ દરેકને થાય એ સ્વાભાવિક છે.

સડબરી સ્થિતિ ઓરેકલપોલ રીસર્ચના પ્રેસીડેન્ટ પોલ સેસ્કાપીના કહે છે કે, લોકો માટે મતદાન કરતી વખતે શું કરવું એ દુવિધા સમાન બન્યું હતું. ક્યા પક્ષની વાતને માનવી એ મુશ્કેલ હતું.

ટીમીન્સની નોર્ધન કોલેજમાં ટેક્સન શીખવાડનારા જેસન બોઈસોનોલ્ટ કહે છે કે, લોકો માટે મહિનાના અંતે કેટલી બચત થશે એ નક્કી કરવાનું મુશ્કેલ છે ત્યારે કોના વચન ઉપર ભરોસો રાખવો.

કોઈ પાર્ટીએ ફુગાવો કેવી રીતે ઘટાડી શકાય એની વાત કરી નથી. પ્રોગ્રેસીવ કન્ઝર્વેટિવના મંચ ઉપરથી ફોર્ડ સરકારે જે લોકો અઠવારિયે

૧૫ ડોલરની બચત કરવા માંગતા હોય તેમને માટેની યોજનાઓની ચર્ચા કરી હતી, અને એને માટે ગેસ ઉપરના ટેક્સને ઘટાડવાની જોગવાઈ બજેટમાં કરાઈ હોવાનું જાહેર કરાયું હતું. બોઈસોનોલ્ટ કહે છે કે, સરકારે ટેક્સ કેડસ્ટ આપવાની વાત કરી છે, પણ એનાથી ઓછી કે મધ્યમ આવક ધરાવનારાઓના બજેટમાં કોઈ મોટો ફેર પડશે નહીં. તમારા બિરસામાં પૈસા બચશે જ એવું નથી. કેમ કે એ કેડીટ તો વર્ષના અંતે તમારા ખાતામાં જમા થશે. આવા વચનો લોકોને ગુંચવી નાંખનારા હોય છે એટલે આવી ચૂંટણીથી કોઈનું ભલું થઈ નહીં શકે.

## તમામ સાંસારિક અને આધ્યાત્મિક પ્રશ્નોનો અંતિમ ઉકેલ ગીતામાં છે : સ્વામી જ્ઞાનાનંદજી



રાશી અને નવલ બજાજના નિવાસ સ્થાને મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજી મહારાજની પધરામણી

ઓન્ટેરિયો

મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ એ સ્વામી જ્ઞાનાનંદજી અથવા સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ તરીકે વધુ જાણીતા, એક ભારતીય મહામંડલેશ્વર સંત છે. જેઓ ભગવદ ગીતા પરના સંશોધન માટે જાણીતા છે અને ગીતા અંગેના વક્તા છે. તેમણે ગીતાનું અર્થઘટન કર્યું છે અને વૈશ્વિક સ્તરે ઘણા વ્યાવસાયિકોને પ્રેરણા આપી છે.

તે હિંદુ ફિલોસોફર અને સામાજિક કાર્યકર પણ છે. તેઓ "શ્રી કૃષ્ણ કૃપા સેવા સમિતિ" નામની વૈષ્ણવ ધર્મને અનુસરતી સંસ્થાના સ્થાપક છે. તેમણે ભગવદ ગીતાના પ્રચાર માટે "GIEO GITA" નામની બીજી સંસ્થાની પણ સ્થાપના કરી છે, તેથી તેઓ ગીતા મનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદજી મહારાજ તરીકે પણ ઓળખાય છે. 2016માં તેમણે ગીતા સંશોધન કેન્દ્રની સ્થાપના કરી હતી. જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમના ઉપદેશોએ હજારો લોકોને પ્રભાવિત કર્યા છે. તાજેતરમાં નવલ બજાજના નિવાસસ્થાનની મુલાકાત દરમિયાન, સ્વામીજીએ માનવના રોજિંદા જીવનમાં શ્રી ભગવદ ગીતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે ગીતા માત્ર એક ધર્મ પુસ્તક મર્યાદિત નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે છે. તમામ સાંસારિક અને આધ્યાત્મિક પ્રશ્નોનો અંતિમ ઉકેલ શ્રી ભગવદ ગીતામાં સમાયેલો છે. તેમના વિવિધ પ્રસિદ્ધ અવતરણોમાં, તેમણે જણાવ્યું કે આજના યુવાનો પણ તેમની ચિંતા અને તણાવ તથા હતાશાના તમામ ઉકેલો આ પવિત્ર પુસ્તકમાં શોધી શકે છે. ગીતાના ઉપદેશને જીવનમાં અમલમાં મૂકવાથી કેવી રીતે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવામાં મદદ મળશે. પૃથ્વી પરના તમામ જીવો પ્રત્યે તમારો પ્રેમ અને લાગણી દર્શાવો. નવલ બજાજ સ્વામીજીનો આભાર માનતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, પવિત્ર ભગવદ ગીતાના ઉપદેશનો અમલ કરવાથી વ્યક્તિને વધુ સારા માનવ બનવામાં મદદ મળે છે. ભગવદ ગીતા એ આધ્યાત્મિક ગ્રંથ નથી, પણ જીવન જીવવાનો માર્ગ છે. તેમણે સૌને ગીતા મહોત્સવનો ભાગ બનવા અનુરોધ કર્યો હતો.

## THINKING OF

## BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.  
મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

**SUBHRO CHAKRABORTY**  
SALES REPRESENTATIVE

**SUDHIR PARMAR**  
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

- Residential
- New Construction
- Investment
- Commercial

**MOHAMMAD ABOWATH**  
SALES REPRESENTATIVE

**MAAZ ABOWATH**  
BROKER - TEAM LEADER

**IBRAHIM ABOWATH**  
SALES REPRESENTATIVE

416 893 4585

# ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

#1

RE/MAX

#SellwithABOWATH your Local REALTOR

મિસિસાગાના ટુરીઝમ સેક્ટરને ફાયદો કરાવવા ફેડરલ સરકારને અપીલ

# પીયરસન એરપોર્ટ પર યાત્રા પ્રક્રિયામાં થતાં વિલંબની સમસ્યા દૂર કરવા તાકીદ

કોવિડ ટેસ્ટિંગ અને આરોગ્યને લગતી તપાસ વારંવાર કરાતી હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી

ટોરોન્ટો

મિસિસાગાના અધિકારીઓએ ફેડરલ સરકારને સોમવારે જણાવ્યું હતું કે, તેમણે પીયરસન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર થતા વિલંબને રોકવા તત્કાળ પગલા લેવા જોઈએ. આ વાત ચલાવી લેવાય એવી નથી. તેમણે કહ્યું હતું કે, આ બાબતની અસર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ પ્રમાણમાં થાય છે. કેમ કે, કોવિડ-19ના ટેસ્ટિંગ અને આરોગ્યને લગતી તપાસ વારંવાર કરવામાં આવતી હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડે છે અને આખરે એની અસર ઉનાળુ વેકેશન માણવા આવનારા પ્રવાસીઓના પ્રમાણ ઉપર પણ પડે છે. જેને કારણે ટુરીઝમને પણ નુકસાન થઈ શકે છે. મિસિસાગાના મેયર બોની કોમ્બીએ પત્રકારો સાથેની વાતચીતમાં આમ કહ્યું હતું. તેઓ નેશનલ ટુરીઝમ વીકની ઉજવણી માટે બ્રીફિંગ કરી રહ્યા હતા. આ પત્રકાર પરિષદ ટર્મીનલ વનમાં યોજાઈ હતી. જ્યાં અન્ય નેતાઓએ પણ વક્તવ્યો રજૂ કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે પ્રવાસીઓને સારો અનુભવ થાય એ જરૂરી છે, આપણે એ દિશામાં વધુ સારું કામ કરવું જ જોઈએ.

પાસ કરીને પીયરસન એરપોર્ટ ઉપર વધુ વિદેશી પ્રવાસીઓ આવતા હોવાથી અહીં વધુ ધ્યાન આપવું પડશે. સાથે સાથે ફેડરલ સરકારે આ સમસ્યા ઉપર વધુ ધ્યાન આપવું પડશે. મિસિસાગાનું ટુરીઝમ સેક્ટર આ પ્રાંતનું પ્રવેશદ્વાર ગણાય છે. જો પ્રવાસીઓને સારો અનુભવ થશે તો એ લોકો બીજાવાર આવવા વિચારશે. એરપોર્ટ પરની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવી જરૂરી છે. કોમ્બીએ કહ્યું હતું કે, કેનેડા અને અમેરિકાની સરકારો પણ સમજે છે કે લોકોને વધુ સમય રાહ જોવી પડે એ સમસ્યા બની શકે છે. મિસિસાગા આ અંગે શક્ય મદદ કરવા તૈયાર છે. જો ફેડરલ સરકાર કેટલીક વારંવાર તપાસની પ્રક્રિયા ઘટાડે તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે. આ પ્રસંગે ફેડરલ સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર અને પબ્લિક સેફ્ટી મિનીસ્ટરે પણ વક્તવ્યો રજૂ કર્યા હતા.

# બેંક ઓફ કેનેડાએ બેન્ચમાર્ક વ્યાજ દર વધારીને 1.5% કર્યો

મોરગેજ અને ક્રેડિટની અન્ય લાઇન માટે ઉધારીના દરમાં વધારો થશે

ટોરોન્ટો

બેંક ઓફ કેનેડાએ બુધવારે તેનો બેન્ચમાર્ક વ્યાજ દર વધારીને 1.5 ટકા કર્યો હતો અને સંકેત આપ્યો હતો કે વધુ વધારો થવાની તૈયારીમાં છે. સેન્ટ્રલ બેંક દ્વારા તેના દરમાં અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય અપેક્ષિત હતો. કારણ કે, તે ઊંચા કુગાવા પર આક્રમક રીતે લગામ લગાવે છે. એપ્રિલમાં કુગાવો 6.8 ટકા ઉપર પહોંચ્યો હતો, જે સેન્ટ્રલ બેન્ક જે લેવલ ઈચ્છે છે તેના બમણા કરતાં પણ વધુ છે. શૂન્યાવકાશમાં, મધ્યસ્થ બેંકો સુસ્ત અર્થતંત્રને ઉત્તેજિત કરવા માટે ઉધાર લેવા અને રોકાણને પ્રોત્સાહિત કરવા વ્યાજ દરોમાં ઘટાડો કરે છે, અને જ્યારે તેઓ અર્થતંત્રને ઠંડુ કરવા માંગે છે

ત્યારે તેઓ દરમાં વધારો કરે છે. બીજા ઘણા દેશોની જેમ, કેનેડાએ COVID-19 રોગચાળાના શરૂઆતના દિવસોમાં ધિરાણ દરમાં ઘટાડો કર્યો હતો. પરંતુ તે રેકોર્ડમાં નીચા ઉધાર દરોએ કુગાવો વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે, જે સેન્ટ્રલ બેંકને દિશા બદલવા માટે પ્રોત્સાહિત કરે છે. સેન્ટ્રલ બેંક કહે છે કે હજુ પણ વસ્તુઓના ભાવ ટોચ ઉપર પહોંચ્યા હોય તેમ નથી લાગતું, બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નજીકના સમયાવાસમાં સંભવતઃ ભાવ વધુ ઊંચે જશે.” આ વધારો બેંકના દરને 1.75 ટકાના સ્તરના એક ક્વાર્ટરની અંદર લાવે છે જે તે રોગચાળા પહેલા હતો, અને બેંક તેના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે દર વધારવાનું આયોજન છે. સેન્ટ્રલ બેંક એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કુગાવો લક્ષ્ય કરતાં વધુ સારી રીતે ચાલુ છે અને નજીકના ગાળામાં ઊંચો જવાની ધારણા છે.

# કેનેડાએ પુટીનની કથિત સ્ત્રીમિત્રનું નામ પ્રતિબંધિત યાદીમાં સામેલ કર્યું

યુક્રેન ઉપર હુમલાના વિરોધમાં કેનેડાએ વધુ એક પગલું ભર્યું ઓન્ટેરિયો



કેનેડાએ એલિના કાબેવાનું નામ પ્રતિબંધિત યાદીમાં સામેલ કર્યું છે, જે રશિયન પ્રમુખ વાલ્ડામીર પુટિનની સ્ત્રીમિત્ર હોવાના અહેવાલો છે. રશિયાની સરકારના નિકટતમ ગણાતા ૨૨ લોકોની યાદીમાં પૂર્વ ઓલિમ્પીયન જીમનાસ્ટનું નામ પણ છે, જેમના પર હાલના યુક્રેન પરના હુમલા બાદ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

યુક્રેને આ મહિનાના આરંભે જ કાબેવા ઉપર યુરોપિયન યુનિયનમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ જાહેર કરી દીધો હતો.

તેમણે પણ એવા લોકોની યાદીમાં એનું નામ સામેલ કર્યું હતું. તે સમયે વિદેશી

બાબતોના મિનીસ્ટર મેલેની જોલીએ કહ્યું હતું કે, આવી પગલું તેઓ પણ લઈ શકે છે. કેમ કે, કેનેડા પણ રશિયાના લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવા માંગે છે. અમે પુટીનની સરકાર અકળાય એવું ઈચ્છીએ છીએ. આ યુધ્ધ શરૂ થયું ત્યારથી અમે યુક્રેનને કેવી રીતે મદદ કરી શકાય એ વિશે વિચારી રહ્યા હતા, જોલીએ મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં આમ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, કેનેડા અને તેના સાથીઓ એવા લોકો ઉપર પ્રતિબંધ લાદવા માંગે છે પણ એને માટે બધા વચ્ચે સંકલનની પણ એટલી જ જરૂર છે.

# બીસીમાં ઓછી માત્રામાં પ્રતિબંધિત ડ્રગ્સ ધરાવનારને છુટછાટના સંકેત

પ્રાથમિક તબક્કે નિર્ણયની અસર ચકાસ્યા બાદ કાયદામાં ફેરફાર થશે ક્યુબેક



બ્રિટિશ કોલંબિયાના તરૂણો જેમની પાસે નજીવી માત્રામાં પ્રતિબંધિત ડ્રગ્સ હશે તેમની સામે ગુનો નહીં નોંધાય એવી જાહેરાત કેનેડાની ફેડરલ સરકારે મંગળવારે કરી હતી. જો કે, આ છુટછાટ આવતા વર્ષથી મળશે. અને તે પ્રાયોગિક ધોરણે હશે. ફેડરલ સરકાર કહે છે કે, કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ૧૮ વર્ષ કે એનાથી વધુ વયના લોકો કુલ ૨.૫ ગ્રામ જેટલું ડ્રગ રાખી શકશે. જેમાં ઓપિયોઇડ્સ, કોકેઇન, મેથામ્ફેટેમાઇન અને એમડીએમએનો સમાવેશ થાય છે, જેની માંગણી પ્રાંતીય સરકારે કરી હતી.

જે આ પ્રકારની પહેલી માંગણી હતી. સરકારે કહ્યું હતું કે, ઓછી માત્રાને ધ્યાને રાખી સરકાર નવા સુધારાનો અમલ ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૩થી કરશે. જે ૩૧મી જાન્યુઆરી ૨૦૨૬ સુધી રહેશે. જો ત્યા સુધીમાં કાનૂનમાં સુધારો થઈ ગયો હશે તો એ કાયમ રહેશે. અથવા એમાં પણ ફેરફાર થઈ શકે છે.

આ છુટછાટનો અર્થ એવો હશે કે જેમની પાસે ૨.૫ ગ્રામથી ઓછી માત્રામાં ડ્રગ હશે તેમની સામે કોઈ ગુનો દાખલ

નહીં થાય અને તેમની ધરપકડ પણ નહીં કરાય કે ડ્રગ કબજે નહીં લેવાય, આ જાહેરાત ફેડરલ સરકારના મિનીસ્ટર ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ એડિશનલ કેરોલીન બેનેટ અને પ્રાંતના તેમના સમકક્ષ શીલા માલ્કોમસને વાનકુંવરમાં મંગળવારે કરી હતી.

કોવિડ-19 મહામારીના સમયે શહેરમાં ૨,૨૨૪ શંકાસ્પદ ઝેરી ડ્રગ્સ સેવનને કારણે થયેલા મૃત્યુના કિસ્સા જોયા હતા જે ઓવરડોઝને કારણે થયા હતા. જે ૨૦૧૬ની સરખામણીમાં ૮૪૦૦ જેટલા હતા. આજે અમે જે પહેલ કરી રહ્યા છીએ એ નીતિ પરીવર્તન માટે મોટા પગલા સમાન છે. આ પગલાને કારણે શું ફેરફારો જોવા મળશે એનો અભ્યાસ પણ થશે, પછી જ કાયમી નિર્ણય કરાશે.

# કેનેડામાં એક મિલિયનથી વધુ નોકરી ખાલી આવાસ અને ખાદ્ય સેવામાં નોંધપાત્ર અસર

સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ નોકરીની ખાલી જગ્યાઓ, પગારપત્રક અને કમાણી અંગે અહેવાલ જાહેર કર્યો

ઓન્ટેરિયો

સ્ટેટિસ્ટિક્સ કેનેડાનો રિપોર્ટ દર્શાવે છે કે, કેનેડામાં નોકરીની ખાલી જગ્યાઓ અત્યારે સૌથી વધુ પ્રમાણમાં ખાલી છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના નોકરીની ખાલી જગ્યાઓ, પગારપત્રક અને કમાણી અંગેના નવીનતમ અહેવાલ મુજબ કેનેડિયન એમ્પ્લોયરો માર્ચ 2022ની શરૂઆતમાં 10 લાખથી વધુ ખાલી જગ્યા ભરવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યા હતા.

કેનેડામાં નોકરીની ખાલી જગ્યાઓની સંખ્યા માર્ચમાં 1,012,900ની રેકોર્ડ-ઉચ્ચ સપાટીએ પહોંચી છે, જે સપ્ટેમ્બર 2021માં અગાઉના 988,300ના રેકોર્ડ કરતાં ઘણી વધુ છે. ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે 186,400 ખાલી જગ્યાઓમાં વધારો થયો હતો. જોબ વેકેન્સી રેટ, જે ખાલી પડેલી અને ભરેલી જગ્યાઓના પ્રમાણ તરીકે ખાલી જગ્યાઓની સંખ્યાને માપે છે, તે 5.9%ની વિક્રમી ઊંચી સપાટી સાથે મેળ ખાય છે. જે ગયા સપ્ટેમ્બરમાં હતો. આવાસ અને ખાદ્ય સેવાઓ તેમજ છૂટક વેપાર બંનેમાં ખાલી જગ્યાઓમાં એક તૃતીયાંશ કરતાં વધુ વધારો થયો છે. આવાસ અને ખાદ્ય સેવાઓના એમ્પ્લોયરો લગભગ 158,100 જગ્યાઓ ભરવા માંગે છે અને છૂટક નોકરીદાતાઓ પાસે લગભગ 109,200 જગ્યાઓ છે. આરોગ્ય સંભાળ અને સામાજિક સહાય તેમજ બાંધકામમાં નોકરીની ખાલી જગ્યાઓનું



રેકોર્ડ લેવલ હતું. આરોગ્ય સંભાળ અને સામાજિક સહાયના એમ્પ્લોયરો 154,500 ખાલી જગ્યાઓ ભરવા માંગે છે, અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં નોકરીદાતાઓ 81,900 કર્મચારીઓની શોધ કરી રહ્યા હતા. તમામ પ્રાંતોમાં નોકરીની ખાલી જગ્યાઓ હતી. સાસ્કાયેવન, નોવા સ્કોશિયા અને ન્યુફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોરમાં મહિના-દર-મહિનાનો સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો.

નોવા સ્કોશિયા, મેનિટોબા, સાસ્કાયેવન અને બ્રિટિશ કોલંબિયામાં નોકરીની ખાલી જગ્યાઓની સંખ્યા વિક્રમજનક ઉચ્ચ સ્તરે પહોંચી છે. સપ્ટેમ્બર 2021થી સળંગ પાંચ મહિના સુધી નોકરીની ખાલી જગ્યાઓ ઘટી હતી, જે સિઝનલ માંગને કારણે થયું હતું. કેનેડામાં, વસંત અને ઉનાળામાં આર્થિક પ્રવૃત્તિ વધે છે અને શિયાળામાં એમાં ઘટાડો થાય છે.

# આપણે હજુ પણ રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ - જસ્ટીન ટ્રુડો

ટોરોન્ટો

પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓ રાહતની માંગ કરવા માટે ઓટાવામાં ભેગા થયા હતા, ત્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ COVID-19ને કારણે સરહદ ઉપરના પ્રતિબંધોના તાજેતરમાં કરેલાં એક્સટેન્શનનો બચાવ કર્યો છે.

ટ્રુડોએ કહ્યું કે, કેનેડા હજુ પણ રોગચાળા અને પ્રતિબંધો હટાવવાની વચ્ચેના સમયાવાસમાં છે. જેમ કે, વિદેશી પ્રવાસીઓએ પોતાના પ્રવેશ ઉપર કોવિડ-19ના રસીકરણનો પુરાવો દર્શાવવો જરૂરી છે, નહીં તો બહુ જલ્દી પર્યટન ક્ષેત્ર માટે ખરાબ પરિણામો આવી શકે છે. વાસ્તવિકતા એ છે કે, લોકો દેખાડો કરે છે કે આપણે મુશ્કેલીમાં નથી, પણ આપણે હજુ પણ રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ. આજે પણ ઘણાં કેનેડિયનો COVID-19ને કારણે દરરોજ મૃત્યુ

પામે છે. તેમણે બુધવારે પત્રકારોને કહ્યું હતું કે, હું જાણું છું કે લોકો પોતાને ગમતી બાબતો ફરી કરવા આતુર છે. પરંતુ જો એને કારણે કોરોનાની બીજી લહેર આવશે તો આપણા પર્યટન ઉદ્યોગને વધુ નુકસાન થશે.” ઉદ્યોગ જૂથોએ બુધવારે પાછી એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઉનાળુ વેકેશનની મુસાફરીની મોસમ માટે સમયસર લાઇનઅપ અને વિલંબ જેવા મુદ્દાઓને દૂર કરવા ફેડરલ સરકારને હાકલ કરતાં કહ્યું હતું કે, “અમે કેનેડિયનોને સુરક્ષિત રાખવા માટે અમારો ભાગ ભજવ્યો છે અને હવે આખરે સ્વસ્થ થવાનો અમારો વારો છે. મુસાફરી હવે પડકારરૂપ બની હોવાથી અમે બહુ મુશ નથી. પરંતુ અમારા કેનેડિયન એરપોર્ટ પર મુસાફરોનો અનુભવ પણ એક પડકાર છે. એમ હોટેલ એસોસિયેશન ઓફ કેનેડાના પ્રમુખ અને સીઈઓ સુસી ગ્રિનોલ્ડે જણાવ્યું હતું.

તંત્રી સ્થાનેથી

# રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી રાજકીય પક્ષોને કોસ વોટીંગનો ડર

ભારતીય રાજકારણમાં આજકાલ રાજ્યસભાની ચૂંટણીનો પારો ઉચે ચઢી રહ્યો છે. આગામી 10 જૂને 15 રાજ્યોની 57 બેઠકો માટે આ ચૂંટણી યોજાવાની છે. રાજ્ય



તંત્રી - પ્રકાશક  
સ્વદેશ

સભાના સાંસદની ચૂંટણીમાં વિધાનસભ્યો અને સાંસદોના મતો મળીને બેઠકનું પરિણામ નક્કી થતું હોય છે, એ જોતાં જરાક ભૂલ થાય તો રાજકીયપક્ષે બેઠક ગુમાવવી પડતી હોય છે. જેને કારણે જ આ ચૂંટણી રસાકસીભરી હોય છે. ભારતમાં સંસદના બે ગૃહ લોકસભા અને રાજ્યસભા છે. કોઈપણ સરકારને આ બંને ગૃહમાંથી બિલ પસાર કરાવવા પડતા હોય છે. તેથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભામાં પણ જે તે પક્ષે પોતાના સભ્યો વધારવાની વેતરણ કરવી પડતી હોય છે.

જોકે ચૂંટણી માટેની સામાન્ય ગણતરી માંડીએ તો કોંગ્રેસને 57માંથી 11 સીટો મળી શકે છે. આ સાથે ગૃહમાં પાર્ટીની સીટોની સંખ્યા 29થી વધીને 33 થઈ શકે છે. જયરામ રમેશ, ગુલામ નબી આઝાદ, પી. ચિદમ્બરમ, રાજીવ શુક્લા, અજય માકન, રણદીપ સૂરજેવાલાના નામની ચર્ચા થઈ રહી છે. પવન બેડા, તારિક અનવર અને પ્રમોદ તિવારી પણ ટિકિટવાંચ્છુઓની રેસમાં હોવાનું ચર્ચાય છે. કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનની ત્રણેય બેઠકો જીતવા પ્રયાસ કરી રહી છે.

છત્તીસગઢની બે બેઠકો મળશે. તમિલનાડુ, ઝારખંડની એક-એક બેઠક પણ કોંગ્રેસના ફાળ જશે, તો હરિયાણા, એમપી અને કર્ણાટકમાં પણ કોંગ્રેસને એક-એક બેઠક મળવાની આશા છે. વર્તમાન ગણિત મુજબ કોંગ્રેસને રાજસ્થાનમાં ત્રણ, છત્તીસગઢમાંથી બે, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને મધ્યપ્રદેશમાં એક-એક બેઠક મળી શકે છે. જો તમિલનાડુમાં શાસક ડીએમકે અને ઝારખંડમાં જેએમએમ એક-એક સીટ આપે તો કોંગ્રેસને વધુ બે સીટો મળી શકે છે. પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ તમિલનાડુની બેઠક ઉપરથી રાજ્યસભામાં પહોંચવાની મનસા સેવી રહ્યા છે. તેઓ ડીએમકેના નેતા અને મુખ્યમંત્રી સ્ટાલિનને પણ મળ્યા છે. આ ચૂંટણી જંગ માટે ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય છે. પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્લાસ નકવી ભાજપમાંથી રાજ્યસભામાં જનારા સંભવિત ચહેરાઓ બની શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના સંજય રાઉત અને સંજય પવારે રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે. બે બેઠકો તો તે જીતી જ શકે છે, પરંતુ ત્રીજી બેઠક માટે પણ શિવસેના પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની કુલ 6 સીટો ઉપર જંગ છે. અહીં જીતવા માટે 42 ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. ભાજપ પાસે બે બેઠકો જીતવા માટે પૂરતી સંખ્યા છે. જયારે સત્તાધારી શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ અલગ-અલગ એક-એક ઉમેદવારને જીતાડી શકે છે. પરંતુ જો તેઓ સાથે આવે તો તેઓ રાજ્યસભામાં બીજા ઉમેદવારને મોકલી શકે છે. હકીકતમાં 288 વિધાનસભ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 106 તથા શિવસેના પાસે 55, એનસીપી પાસે 53, કોંગ્રેસ પાસે 44, બસપા વિકાસ અઘાડી પાસે 3 અને સમાજવાદી પાર્ટી તથા એઆઈએમઆઈએમ અને પ્રહાર સક્તિ પાર્ટી પાસે બબ્બે ધારાસભ્યો છે. તેથી શિવસેના અને તેનું ગઠબંધનવાળી સરકાર રાજ્યસભા માટે મહારાષ્ટ્રમાંથી ત્રીજો ઉમેદવાર મોકલવા માથાપચ્છી કરી રહ્યા છે. આ ઉપરાંત યુપી અને બહિરામાં ચૂંટણીને લઈને વધુ ઉત્સાહ છે. થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા સિબ્બલે પાર્ટીને અલવિદા કહીને સપામાંથી રાજ્યસભા

માટે ફોર્મ ભર્યું હતું. જયારે બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીમાં સત્તા ન મળી હોવા છતાં, એસપી, આરએલડી તેમની એકતા વધુ બતાવી રહી છે. રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરી ઉત્તરપ્રદેશથી રાજ્યસભાની ચૂંટણીમાં સપા અને આરએલડીના સંયુક્ત ઉમેદવાર હશે. ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની 11 બેઠકો માટે 10 જૂને મતદાન થશે. કોંગ્રેસના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય જાવેદ અલીએ સપા તરફથી ઉમેદવારી નોંધાવી છે. 403 સભ્યોની ઉત્તરપ્રદેશ વિધાનસભામાં સપાના 111 સભ્યો છે અને તે પોતાના ત્રણ ઉમેદવારોને સરળતાથી રાજ્યસભામાં મોકલી શકે છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ 11માંથી 8 બેઠકો ઉપર ચૂંટણી લડવા માંગે છે, જયારે તેની પાસે આઠમી બેઠક જીતવા માટ સંખ્યાનો અભાવ છે. બીજી તરફ સપા છે, જે ત્રણ બેઠકો જીતી શકે છે અને ચોથા ઉમેદવારને ઊભા કરી શકે છે અથવા ભાજપને આઠમી બેઠક પર જતા અટકાવવા માટે અન્ય કોઈ ઉમેદવારને સમર્થન આપી શકે છે. ભાજપ દ્વારા કેન્દ્રીય નેતૃત્વને 21 નામ મોકલવામાં આવ્યા છે. તેમાંથી 8 નામો પસંદ કરાશે. યુપીમાં જો સમાજવાદી પાર્ટી ઉમેદવારને મેદાનમાં ઉતારશે તો 10 જૂને મતદાન થશે. જો આમ થશે તો રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાનો રોલ ઘણો મોટો બની જશે. નંબર ગેમ પરિસ્થિતિને સ્પષ્ટ કરી શકે છે. ભાજપ ગઠબંધન પાસે 273 ધારાસભ્યો છે. સપા ગઠબંધન પાસે 125 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 2, રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાની પાર્ટી જનસત્તા પાર્ટી પાસે 2 અને બસપા પાસે 1 ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં, જો કોઈ ઉમેદવાર 31 મે સુધીમાં ઉમેદવારી નોંધાવે છે અને તેની તરફેણમાં પૂરતા ધારાસભ્યોના સમર્થનનો દાવો કરે છે, તો ચૂંટણી નિશ્ચિત છે. અહીં બસપાના ધારાસભ્ય રાજા ભૈયા યુપીના આઠમાં ઉમેદવારનો નિર્ણય કરશે. સપાને હાલ એવો ડર છે કે, આઝમખાનના રૂપમાં પહેલાથી જ વિખવાદ છે અને હવે સિબ્બલે પાર્ટી તરફથી દાવેદારી કરી છે. વળી, શિવપાલ યાદવ પણ સપામાં ઘણાં સમયથી બગાવતી સૂર દાખવી રહ્યા છે. આ ઉપરાંત અબિલેશથી અન્ય કેટલાક નેતાઓ પણ નારાજ હોવાથી સપાને કોસ વોટીંગનો ભય છે. આ જ કારણે તે ચોથો ઉમેદવાર ઉભો રાખવા માંગતી નથી.

અન્ય એક રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસના 108, ભાજપના 71, રાષ્ટ્રીય લોક તાંત્રિક પાર્ટીના 3, સીપીઆઈ અને બીટીપીના બ-બે ધારાસભ્યો છે. રાજસ્થાનમાં રાજ્યસભાની કુલ 10 બેઠકો પૈકી ચાર ખાલી છે. અહીં આમ તો કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે પરંતુ ગહેલોત અને પાયલટ જૂથની લડાઈની ચિંતા મોવડી મંડળને સતાવી રહી છે. ગહેલોતના ખાસ ગણાતા ડુંગરપુરના દિનેશ ખોડાનિયાને રાજ્ય સભામાં મોકલવા પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ગહેલોતની આ પેરવી સામે અનેક ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે કારણ કે ખોડાનિયા સામે અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ ચૂક્યા છે. રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચાર બેઠકો ખાલી છે. જેમાં બે બેઠક કોંગ્રેસ આસાનીથી જીતી શકે છે. જયારે ભાજપ એક સીટ જીતી શકે તેમ હોવાથી અહીં ચોથી બેઠક માટે બરેબરાનો જંગ થવાનો છે. રાજસ્થાનની ચોથી બેઠક માટે 13 અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા મહત્વની બની રહેનાર છે. આ ઉપરાંત બિહારમાં પાંચ બેઠકો માટે ચૂંટણી થવાની છે. જેમાં ભાજપ જેડીયુ ગઠબંધન સરળતાથી 3 બેઠક જીતી શકે છે. જયારે વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ અન્ય બે બેઠકો પર પોતાના ઉમેદવાર જીતાડી શકે છે.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

**ARISTO PEST CONTROL**  
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



- ✓ Mice
- ✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



- ✓ Cockroach
- ✓ Bedbug
- ✓ Animal Control

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



- ✓ Bird Control
- ✓ WASPS and
- ✓ Hive Removal

**24 HRS / 7 DAYS EMERGENCY SERVICES  
AND ANIMAL REMOVAL**

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And  
Discounted Rates



**CALL SANKET TRIVEDI - 647.339.3926**  
Government Licensed Structural Exterminator



**DIVINE YOGA**



By Geeta

**Children Yoga Class**

Every Tuesday 5-6 PM

**Adult Yoga Class**

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

: Classes Available :  
One to One Individual  
and Therapeutic

**Geeta Tailor**  
**416-456-2261**

Contact Geeta at  
divineyogabygeeta@gmail.com  
IG & FB: @divineyogabygeeta



# બાધા પર્યાય તતાં લુણાવાડાના ભક્તે મા અંબાને સોનાનાં મુગટ દાન કર્યા

અંબાજી

યાત્રાધામ અંબાજીમાં સોનાના દાનની સરવાણી અવિરત ચાલતી રહે છે. મા અંબાના દર્શને દુનિયાભરમાંથી ભક્તો આવતા છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે. મા અંબાના મંદિરનું શિખર ગુજરાત જ નહીં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેંદ્ર માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.



સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ

પ્રમાણે દાન કરી ચૂક્યા છે. ત્યારે હાલ લુણાવાડાનો એક માઈભક્ત ચર્યાનો વિષય બન્યો છે. માઈભક્તે યાત્રાધામ અંબાજીમાં મા અંબાને સોનાનો મુગટની ભેટ આપી છે. જ્યેષ્ઠ માસના પ્રથમ દિને સુદ એકમે મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ચેનપુર ગામનો એક પરિવાર મંગળવારે માં અંબાના દર્શનાર્થે આવ્યો હતો. જ્યાં પરિવારે મંદિરમાં પુજા અર્ચના કર્યા બાદ સોનાનો મુગટ ભેટ ધર્યો હતો. જોકે માઈ ભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઈન્કાર કર્યો હતો.

## બનાસકાંઠા જિલ્લાના વાવની ખોડાઢોર પાંજરાપોળમાં ૩૦ પશુઓના મોતથી હાહાકાર

વાવ

વાવની ખોડાઢોર પાંજરાપોળમાં શનિવારે રાત્રે અગમ્ય કારણોસર ૩૦ પશુઓના અચાનક મોત થતાં પંથકમાં હાહાકાર મચી ગયો હતો. ૩૦ પશુઓના મોત અંગે જાણ થતાં વેટરનરી તબીબો સાથેની પશુપાલન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃત પશુઓના સેમ્પલ લીધા હતા. પશુઓના મોતનું કારણ જાણવા પાણી અને ઘાસચારાના સેમ્પલ લઈને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલાયા હતા. સેમ્પલો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાય તેમ છે. જ્યારે ભયંકર દુર્ગંધ મારતી હોવાથી રોગચાળો ફેલાય નહી તે માટે સ્થાનિક તંત્ર દ્વારા પશુઓના મૃતદેહના નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી.

## સાબરકાંઠામાં હથિયારો પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ, ૩ કર્મી ઈજાગ્રસ્ત

હિમતનગર

સાબરકાંઠા: પોલીસના કાલીકંકરનાં ગૌરી ગામમાં પોલીસને ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મળી હતી. જેથી ગૌરી ગામે દરોડા પાડવા ગયેલી પોલીસ પર પહેલાથી જ સંતાડી દીધેલા હથિયાર વડે જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક પોલીસકર્મીને પગમાં જ્યારે અન્ય ૩ પોલીસકર્મીને ઈજાઓ થતાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભૂતકાળમાં પણ રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલાની ઘટનાઓ બની ચૂકી છે.

# Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 : Our disinfectant services that we offer are:


- 1 Spray Services
- 2 Fogging Services
- 3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets



Special Service For Bedbug Control  
www.imperialpestcontrol.ca  
info@imperialpestcontrol.ca  
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

# ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

### Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, કટલેસ, ખાસ્તા ક્યોરી, સેવ ઉસળ, સમોસા ચાટ

### Takeout & Catering

Limited થાળી (with sweet & Farsan) \$9.00 +Tax

Limited થાળી (without sweet & Farsan) \$7.50 +Tax



### CATERING SPECIAL

\$ 14.99 10 items +Tax  
Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

# પતિ, પત્ની ઓર વો... : ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી વિવાદોમાં ઘેરાયા

સોલંકીની રંગરેલીયાનો કથિત વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ગલિયારોમાં ખળભળાટ

આણંદ

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની રંગરેલીયાનો કથિત વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા પટેલ જ્યારે ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશે ત્યારે ભરતસિંહ તેમની પત્નીને દરવાજા પર અટકાવે છે તે જ સમયે એક યુવતી જોવા મળે છે. ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ

વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. જેને લઈને ભરતસિંહ સોલંકીએ તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે અરજી પણ કરી છે. પરંતુ રેશમા પટેલ ભરતસિંહ સોલંકીને મનાવવા આણંદ વિધાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા. જ્યાં રેશમા પટેલ ઘરમાં પ્રવેશે છે ત્યાં જ ભરતસિંહ સોલંકી અન્ય યુવતી સાથે પકડાયા હતા. ત્યારે જે યુવતી સાથે ભરતસિંહ પકડાયા છે તે યુવતીને લઈ મોટો ખુલાસો થયો છે. ભરતસિંહ જે યુવતી સાથે પકડાયા

તે યુવતી વડોદરાના મહિલા કોંગ્રેસ નેતાની ભાણી હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ જ આ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે. રેશમા પટેલે વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે. આ મામલે રેશમા પટેલે જણાવ્યું હતું કે, મારા પતિને ઘણા વખતથી હું શોધતી હતી. પણ ગઈકાલે આણંદ વિધાનગર રોડ પર એક યુવતી સાથે તેમને આઈસ્ક્રીમ ખાતા જોયા હતા.

# ઉમરેઠના ધોળી ગામે લગ્નપ્રસંગના વરઘોડામાં મારામારી થતા નાસભાગ વાહન અડી જવા બાબતે તકરારમાં મામલો બિચક્યો

આણંદ

ઉમરેઠના ધોળી ગામે વિક્રમભાઈ સોલંકીના સંબંધીના લગ્નપ્રસંગ નિમિત્તે ગામમાં વરઘોડો ચાલતો હતો. દરમ્યાન આકાશભાઈ ચીમનભાઈ પરમાર પોતાનું ટુલ્કીલર લઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જેણાભાઈને ટુલ્કીલર અથડાવી આકાશભાઈ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. જેની રીષ રાખી થોડા સમય બાદ સુભાષભાઈની ગાડી ધોળી-ખંભોળજ માર્ગ પરથી પસાર થતી હતી ત્યારે વિજયસિંહ જીલુભાઈ ઝાલાએ પોતાની મોટરકાર રસ્તા વચ્ચે અવરોધરૂપ મુકી દીધી હતી અને

જેણાભાઈને ગમે તેમ અપશબ્દો બોલી માર માર્યો હતો. વિજયસિંહનું ઉપરાણું લઈ આવેલા આકાશ અને રમેશભાઈ પરમાર પણ લાકડી લઈ ત્યાં આવ્યા હતા અને વિક્રમભાઈ તથા ઘરના સભ્યોને ગમે તેમ બિભત્સ અપશબ્દો બોલી માર માર્યો હતો અને વિરેન્દ્રકુમાર તેમજ કોકીલાબેનને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વિક્રમભાઈએ ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ આપ્યા બાદ સામાપક્ષે આકાશભાઈ પરમારે પણ ફરિયાદ નોંધાવી હતી.

# આપણી વિદેશ નીતિ સબ કા સાથના મંત્ર ઉપર આધારિત : એસ. જયશંકર

વડોદરા

ભારત સરકારની વિદેશ નીતિ પણ ઘર આંગણની નીતિની જેમ સબ કા સાથ, સબ કા વિકાસના મંત્ર પર આધારિત છે તેમ વિદેશ મંત્રી એસ.જયશંકરે મંગળવારે એમ.એસ. યુનિવર્સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદી પરના મોદી એટ ૨૦ નામના પુસ્તકના અંશોનુ પઠન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાના અનુભવો અંગે કહ્યું હતું કે, પીએમ મોદીની અલગ અલગ દેશોમાં વસતા ભારતીય સમુદાય સાથેની

નિકટતા વર્ષોથી છે. ઉપરાંત પીએમ મોદી વિદેશોમાં જ્યારે યાત્રા કરતા હોય છે ત્યારે ત્યાંની સારી બાબતોનો ભારતમાં અમલ કરવા માટે પ્રયત્ન કરે છે. પ્રધાન મંત્રી આવાસ યોજના, બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટો તેનું ઉદાહરણ છે. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ મને વિદેશ સચિવ તરીકે સાર્ક દેશોની યાત્રા કરવા માટે કહ્યું હતું અને તેમાં પાકિસ્તાન માટે તેમનો સંદેશ એ હતો કે, આતંકવાદ ચલાવી નહીં લેવાય. આપણી નીતિ ઝીરો ટોલરન્સના પાયા પર આધારિત છે.

# આણંદમાં નજીવી બાબતે તકરારમાં હત્યા કરનારને આજીવન કેદ, 1.45 લાખનો દંડ

મોબાઇલ-ચાવી લેવાના મામલે ઠપકો આપતા હુમલો કરાયો હતો : ૩ સામે ગુનો નોંધાયો હતો

આણંદ

આણંદમાં ૨૦૧૯માં સી.પી. કોલેજ નજીક વડાપાઉની લારી પાસે શશાંક ભાટીયા અને તેનો મિત્ર મૈત્રિક પટેલ ઢાજર હતા. દરમ્યાન નિલેશકુમાર ખુમાનસિંહ પરમાર સહિતના ત્રણ શખ્સોએ ચીમનભાઈનો મોબાઇલ ફોન તથા ચાવી લઈ લીધેલ હોઈ બંને મિત્રોએ નિલેશકુમાર પરમારને ઠપકો આપ્યો હતો. જેને લઈ તકરાર થઈ હતી અને નિલેશે શશાંકને છરીના ઘા મારી દેતા શશાંક લોહીલુહાણ ઢાલતમાં

જમીન ઉપર ફસડાઈ પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ તકરારમાં તેનો મિત્ર મૈત્રિક વચ્ચે પડતા તેને પણ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી નિલેશ પરમાર સહિતના શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મૈત્રિક આશિષભાઈ પટેલે મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિલેશકુમાર ખુમાનસિંહ પરમાર, ખુમાનસિંહ અનવરસિંહ પરમાર અને વિજયભાઈ ઉર્ફે ભયલુ વિનુભાઈ ગોહિલ વિરુદ્ધ

ગુનો નોંધી તા. ૧૧મી નવેમ્બરના રોજ તેઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં આણંદના ચોથા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે સરકારી વકીલની દલીલો તેમજ ૧૪ મૌખિક પુરાવા અને ૪૫ દસ્તાવેજી પુરાવા ચકાસ્યા બાદ ન્યાયાધીશે નિલેશકુમાર પરમારને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી. સાથે સાથે અલગ-અલગ કલમો હેઠળ તેને ૧,૪૫,૦૦૦નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.



## UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

  
**ZIVASA**  
 Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana  
 Broker

# સુરત એરપોર્ટના વિકાસ માટે રૂ. 353 કરોડનો પ્રોજેક્ટ 7 મહિનામાં પૂર્ણ કરાશે

અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગ 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરોને હેન્ડલ કરશે

સુરત

સુરત એરપોર્ટના સર્વગ્રાહી વિકાસ માટેનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ માટે રૂ. 353 કરોડના પ્રોજેક્ટને આગામી મહિનામાં ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું છે. ટર્મિનલ બિલ્ડિંગને વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત 8474 ચો.મિ.થી 25520 ચો.મિ. સુધી વિસ્તારાશે. ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ માટે 58 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. બિલ્ડિંગના વિસ્તરણ ઉપરાંત, એપ્રોનનું 5 પાકગ-બેથી 18 પાકગ-બે સુધી વિસ્તરણ અને સમાંતર ટેક્સી ટ્રેકનું બાંધકામ પણ પ્રગતિમાં છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, નવી અત્યાધુનિક વિસ્તૃત ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક અને 600



ઇન્ટરનેશનલ પેસેન્જરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે, જેની વાષક પેસેન્જર ક્ષમતા 2.6 મિલિયન થશે. તમામ આધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ, ટર્મિનલ બિલ્ડિંગમાં 20 ચેક-ઇન કાઉન્ટર, 5 એરો-બ્રિજ, ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ, મુસાફરો માટે 5 કન્વેયર બેલ્ટ હશે. નવાં ટર્મિનલ બિલ્ડિંગમાં 475 કારની ક્ષમતા સાથે પાકગ એરિયા પણ હશે.

# 550 બનાવટી કંપની ઊભી કરીને બોગસ બિલ બનાવનાર ઝડપાયા

સુરત

સુરત શહેરમાં એક જ રૂમમાંથી 550 બનાવટી કંપનીઓ ઓપરેટ કરીને બોગસ બિલિંગનું કરોડોનું કૌભાંડ કરનારાઓ પાંચ વ્યક્તિઓની મધ્યપ્રદેશના જીએસટી કમિશનરના કચેરીના અધિકારીઓ ગત સપ્તાહમાં સુરતથી ધરપકડ કરીને ઇન્દોર લઈ ગયા છે. સુરતમાં નાનકડી ઓરડીમાંથી ઓપરેટ કરતી પાંચ વ્યક્તિઓએ 550 બનાવટી કંપનીઓના જીએસટી નંબરનો ઉપયોગ કરીને રૂ. 800 કરોડના બિલ બનાવીને તેના પર ઇનપુટ ટેક્સકેડિટ મેળવી હોવાનું બહાર આવ્યું છે. આ કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ

ધરાવતી હતી. તેમણે ઓછામાંઓછી રૂ. 100 કરોડની બોગસ ઇનપુટ ટેક્સકેડિટ મેળવી લીધી હોવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. નાનકડી ઓરડીમાં ચારથી પાંચ ટેલબ અને ખુરશી ગોઠવીને 550 કંપનીઓના બિલિંગ કરવામાં આવતા હતા. આ ઓરડીમાં એક સમયે એકસાથે છથી વધુ વ્યક્તિઓ બેસી શકે તેમ જ નથી. તેમ છતાંય તેમના સરનામા પર 550 બોગસ કંપનીના જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે તેમણે ગરીબોના ઓળખના પુરાવાઓ મેળવીને બોગસ કંપનીઓના નામ આપી જીએસટી રજિસ્ટ્રેશન મેળવી લીધા હતા.

## મૂળ વલસાડની દીકરી હુમેરા લંડનમાં કાઉન્સિલમાં સ્પીકર તરીકે ચૂંટાઈ

વલસાડ

વલસાડના એનઆરઆઈ અને સેવાભાવી મુસ્લિમ મુનાવર ગરાસિયાના ભાઈ રફિકભાઈ ગરાસિયાની પુત્રી હુમેરા ગરાસિયાએ ફરીથી લંડનમાં ભારતીય મૂળના નાગરિક તરીકેનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. તેણીએ વર્ષ 2018માં 19 વર્ષની વયે કાઉન્સિલરની પદવી અને હવે 21 વર્ષની વયે સૌથી નાની વયની સ્પીકર બની એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. હુમેરા લંડનમાં લેબર પાર્ટીની કાર્યકર છે. તેણી યુવાવસ્થાથી જ સેવાના કાર્યમાં જોડાઈ ગઈ હતી. તેમજ તેણે રાજકીય પક્ષ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. પ્રથમ વખત જ તેણીએ હેકનીની કાઉન્સિલની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ત્યાર બાદ હવે તેણી હેકની કાઉન્સિલ (પાલિકા)ની સ્પીકર તરીકે ચૂંટાઈ આવી છે.

## તરૂણીને લગ્નની લાલચે સગર્ભા બનાવનારને 20 વર્ષની સખત કેદ

ઓલપાડના મંદરોઈ ગામના આરોપી રોશન પટેલને 31.20 હજાર ટંડ, ભોગ બનનાર તરૂણીને 1.75 લાખ વળતર ચૂકવી આપવા હુકમ

ઓલપાડ

એક વર્ષ પહેલા ઓલપાડ વિસ્તારની 16 વર્ષની તરૂણીને લગ્નની લાલચ આપી કારમાં લઈ જઈને વારંવાર શરીર સબંધ બાંધી સગર્ભા બનાવનાર આરોપી યુવાને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશનલ સેશન્સ જજ દિલીપ પી.મહીડાએ પોક્સો એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી 20 વર્ષની સખતકેદ, રૂ.20 હજાર ટંડ તથા ટંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી છે.

16 વર્ષની તરૂણીને 28 વર્ષીય આરોપી રોશન ગોમાન પટેલ (રે.પાકીસ્તાન ફળીયું,

મંદરોઈ તા.ઓલપાડ) સાથે ઓક્ટોબર-2020 દરમિયાન નવરાત્રિમાં ગરબા રમવા જતી વખતે મિત્રતા થઈ હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપી તરૂણીને ટ્યુશન ક્લાસમાંથી પોતાની કારમાં અવાવરુ જગ્યાએ લઈ જઈ મરજી વિરુદ્ધ એકથી વધુવાર શરીર સબંધ બાંધતા તરૂણીને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. આ અંગે માતાએ પુછ્યા બાદ તરૂણીએ આરોપી રોશન પટેલે બળાટકાર ગુજાયાની વાત કરતા માતાએ તા.21-5-2021ના રોજ આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવતા ધરપકડ કરાઈ હતી.

## કેદારનાથ યાત્રા ગયેલા વલસાડના યુવકનું ખીણમાં પડી જતાં મોત

વલસાડ

પારડીના કલસર ગામના 40 ભક્તોનું ગ્રૂપ થોડા દિવસ પહેલા ચારધામની યાત્રાએ ગયું હતું. જેમાં કલસર ગામના સડક ફળિયામાં રહેતા ધનિશ ભીકુભાઈ પટેલ (ઉંમર 32 વર્ષ) પણ આ ગ્રૂપ સાથે ચારધામ જાત્રાએ ગયો હતો. સૌપ્રથમ તેઓ હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યાં ધનિશ પટેલ પડ્યો હતો, અને તેના માથામાં ઈજા પહોંચી હતી. જોકે, ઈજા સામાન્ય હોવાથી તે ગ્રૂપ સાથે પ્રવાસમાં આગળ વધ્યો હતો. તેના બાદ તેઓ કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં રામપુર ખાતેની એક હોટલમાં રોકાણ કર્યું હતું. રામપુરમાં વહેલી સવારે ધનિશ કામથી હોટલ બહાર નીકળ્યો હતો, જ્યાં તે નજીકની એક ખીણમાં પડી ગયો હતો. જેના બાદ ધનિશનો મૃતદેહ પહાડીમાંથી મળી આવ્યો હતો.



**SHARP**  
INTERNATIONAL  
IMMIGRATION SERVICES

**CANADA  
IMMIGRATION**



**SPOUSAL SPONSORSHIP  
SPECIALIST (98 percent success ratio)**

**Last minute student admission**

Please contact us on

**416-745-2466 or 91-9428973911**

- Conestoga
- Fanshawe
- Algoma
- Seneca
- Georgian
- Saskatchewan
- Humber
- Algoma
- polytechnic
- Lambton
- Canadore
- Mohawk

**ONLINE IELTS  
SPOKEN ENGLISH CLASSES  
ON ZOOM**

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS /  
DETENTION REVIEWS /  
CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL  
APPLICATIONS

**CANADA**

94- 499 Main Street South, Shoppers World Mall,  
Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855

**VADODARA**

101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri,  
Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817

**AHMEDABAD**

139 Iscon Emporio, Beside Star Bazaar Satellite  
Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

Email.: info@siis.ca

Website.: www.siis.ca

**: Specialized in :**

**Job Offer & LMIA  
Entrepreneur  
Investor Business  
Self Employed  
Farm Investor**

## ભાવનગરના તળાજામાં પિતા અને પુત્ર ઉપર ફાયરિંગ, દીકરાનું મોત



તળાજા

ભાવનગરના તળાજા તાલુકાના દેવલી ગામે રહેતા દેવાભાઈ બચુભાઈ વાઘેલા અને તેઓનો દિકરો મુકેશભાઈ દેવાભાઈ બન્ને બાઈક નંબર જીજે. ૦૪. ડીએચ-૭૬૬૭ લઈ કાચી કેરી અને કેરીના કેરેટ લઈ શુક્રવારે સવારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પરથી જઈ રહ્યા હતા. તે વેળાએ તળાજાની શેત્રુજી નદીના પુલથી આગળ વેળાવદર ગામ વચ્ચે પહોંચતા તેઓનો બાઈક ઉપર પીછો કરી રહેલ દેવલી ગામનો અને હાલ બપાડા ગામની સિમમાં કેનાલ પાસે

રહેતો મુત્રો ઉર્ફે નારણ ભોળાભાઈ વાઘેલા અને એક અજાણ્યા શખ્સે ચાલુ બાઈકે ફાયરિંગ કરતા પિતા-પુત્ર બાઈક ઉપરથી પટકાયા બાદ રેલીંગ ટપી જીવ બચાવવા ભાગ્યા હતા. પરંતુ બન્ને શખ્સ પૈકી એક ચાલુ બાઈક રાખી ઉભા રહી જ્યારે અન્યએ પીછો કરી ધડાધડ પિતા-પુત્ર ઉપર ફાયરિંગ કર્યું હતું. જે બાદ લોહીથી લથપથ પિતા-પુત્રને તળાજા ૧૦૮ મારફતે તાત્કાલીક સારવાર અર્થે અત્રેની સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મુકેશભાઈ દેવાભાઈ વાઘેલાને તપાસી મૃત જાહેર કર્યા હતા.

## મંદિરના પૂજારીઓને વેતન પ્રથા ચાલુ કરવા માંગણી

દ્રોલ

ભારતભરના મંદિરમાં સેવા પુજા કરતા પૂજારીઓની આર્થિક સ્થિતિ કફોડી હોવાના કારણે સરકારે આ સમુદાયને મદદરેસા અને મૌલવીઓને જેવી રીતે ગ્રાન્ટ અને વેતન અપાય છે એવી જ રીતે પૂજારીઓને વેતન યોજના અંતર્ગત જોડવા માટે દ્રોલ તાલુકાના લતીપર ગામે યોજાયેલા રામાનંદી સાધુ સમાજના સંમેલનમાં માંગ ઉઠાવવામાં આવી હતી. લતીપરના પટેલ સમાજમાં મળેલા સાધુ સમાજના સંમેલનમાં જીવનસાથી પસંદગી મેળો પણ યોજવામાં આવ્યો હતો જેમાં 212 યુવક અને 40 યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં ગુજરાતભરના રામાનંદી સાધુ સમાજના લોકો એકત્ર થયા હતા. ખાસ કરીને રામાનંદી સાધુ સમાજમાં મંદિરના પુજારી હોવાનું ખુબજ મહત્વ છે. પણ બધા મંદિરમાં પુરતી આવક હોતી નથી. આવા સંજોગોમાં સરકારે રાજયાશ્રય આપવો જરૂરી બન્યો છે.

## સેંદરડાના રોજકી ડેમમાં ડબી જતા માતા અને પુત્ર સહિત ચારેના મોત

માતા-દીકરી, પુત્રવધુ ડેમ કિનારે કપડા ધોવા ગયા હતા

મહુવા

મહુવા તાલુકાના સેંદરડા ગામે આવેલ રોજકી ડેમમાં આજે સોમવારે માતા, પુત્ર-પુત્રી સહીત 4 વ્યક્તિ ડૂબી જતા તમામના કરૂણ મોત નિપજવા પામ્યા હતા. મુળ નેપ ગામનો પરિવાર કપડા ધોવા માટે ડેમ કિનારે ગયો હતો તે વેળાએ પુત્ર ડેમના પાણીમાં પડે ડૂબવા લાગતા અન્ય તેને બચાવવા માટે પડતા તમામ ઉડા પાણીમાં ડૂબી જતા કરૂણાર્તિકા સર્જવા પામી હતી. બનાવને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા. અને પોલીસ કાફલો ઘસી આવ્યો હતો. બનાવના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મહુવા તાલુકાના નેપ ગામના વતની અને હાલ મજૂરી કામ અર્થે સેંદરડા ગામે સ્થાઈ થયેલ શ્રમિક પરિવારના મંગુબેન આણંદભાઈ બારૈયા (ઉ.વ. ૪૫), દક્ષાબેન મનુભાઈ શીયાળ (ઉ.વ. ૨૫), મંગુબેનના પુત્રવધુ



કાજલબેન પ્રદિપભાઈ બારૈયા (ઉ.વ. ૨૫) કપડા ધોવા માટે સેંદરડા ગામ નજીક આવેલ રોજકી ડેમના કિનારે કપડા ધોવા ગયા હતા. તે વેળાએ મંગુબેનને પુત્ર નિકુલ આણંદભાઈ (ઉ.વ. ૧૪) તેમની સાથે ગયો હતો. દરમિયાન નિકુલ અકસ્માતે ડેમના પાણીમાં પડી જઈ ઉડા પાણીમાં ડુબવા લાગતા તેને નિહાળી તેના માતા મંગુબેન બાદ બહેન દક્ષાબેન અને કાજલબેન બચાવવા માટે ડેમના પાણીમાં પડતા તમામ ઉડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉક્ત બનાવને લઈ ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ જવા પામ્યો હતો.

## દેશમાં પ્રથમ વખત ડ્રોનના માધ્યમથી કચ્છમાં 2 કિલોનું પાર્સલ મોકલાયું

ભુજ તાલુકાના હબાયથી ભયાઉના નેર ગામ ખાતે પાર્સલ મોકલાયું હતું

ભુજ

અત્યાર સુધી આપણે ડ્રોનની વિવિધ ઉપયોગ જાણ્યા હશે પરંતુ ટપાલના પાર્સલને મુળ વ્યક્તિ સુધી પહોંચાડવા પ્રથમ પ્રયાસ છે. પોસ્ટ વિભાગ દ્વારા ડ્રોનથી ટપાલ સેવા શરૂ કરવા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ભુજ તાલુકાના હબાયથી ભયાઉના નેર ગામની પસંદગી કરવામાં આવી હતી અને 2 કિલોનું પાર્સલ ફક્ત 75 મીનીટમાં 47 કિલોમીટર દૂર પહોંચ્યું હતું. ટ્રાયલબેનના આધારે સફળ પરીક્ષણ કરાયું હતું. ટ્રાયલ



બેઝની ચકાસણી બાદ સરકાર દ્વારા સતવાર માહિતી આપી ડ્રોન ટપાલ સેવા ચાલુ કરવામાં આવશે. હવે પોસ્ટ વિભાગની સેવાઓ પણ ઝડપી અને બહેતર બને તેવો તખતો ઘડાઈ ગયો છે. ડ્રોન મારફત પોસ્ટની પાર્સલ સેવાની ડિલિવરીનું ટેસ્ટિંગ



આખા દેશમાં આજે ત્રણ જ સ્થળે હાથ ધરાયું હતું, જેમાં કચ્છ જિલ્લો પણ સામેલ હતો. ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની હાજરીમાં આજે હબાયથી નેર-બંધડી સુધી ડ્રોન મારફત એક પાર્સલ ગંતવ્યસ્થાને પહોંચાડવાનું સફળ પરીક્ષણ થયું હતું.

## આધુનિક ટેકનોલોજીની મદદથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે

જામખંભાળિયા

દેવભુમિ દ્વારકા જિલ્લામાં ઓખા દ્વારકાની કોસ્ટલ પોલીસીંગની રાષ્ટ્રીય અકાદમીની કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મુલાકાત લીધી હતી. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશની સીમાઓની પવિત્રતા અને સુરક્ષા જાળવી રાખવામાં બીએસએફની કામગીરી સદૈવ સરાહનીય રહી છે. દેશના જુદા જુદા રાજ્યોની મરીન પોલીસને ઉચ્ચ શિક્ષણ આપવામાં નેશનલ એકેડમી ખુબ ઉપયોગી થશે. તેમ તેઓએ જણાવી આધુનિક ટેકનોલોજીની મદદથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

## રાજકોટનાં આંગણે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ

રાજકોટ

રાજકોટનાં આંગણે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા રમતગમત અધીકારીઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજથી સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જિલ્લાનાં અંદાજે ૪ હજાર જેટલા કલાકારો આ પ્રદેશ કક્ષાના ત્રિ-દિવસીય કલા મહાકુંભમાં માગ લેશે. ગુરુવારે પ્રથમ દિવસે આયોજીત સ્પર્ધામાં ભાવગનરનાં કલાકારોનો દબદબો જોવા મળ્યો હતો. લોકનૃત્ય, સમૂહગીત અને ભરત નાટ્યમની સ્પર્ધામાં રાજકોટનાં કલાકારો પ્રથમ વિજેતા થયા હતા.

**First Flight**  
FFCL Couriers Inc.

દુનીયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

**તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ**

<b>1 LB \$20 વધુ દર LB ના \$6</b> <b>11 LB \$55 વધુ દર LB ના \$6</b> <b>23 KG \$185, વધુ દર KG ના \$10</b> <b>30 KG \$230, વધુ દર KG ના \$10</b>	<b>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</b>
---	---

**જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ**

Brampton (West)	Scarborough	Mississauga
519, Ray lawson boulevard, Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM	<b>WE ARE RE-OPENING</b> 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM	<b>WE MOVED TO</b> 6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 ----: SAT-SUN :---- 11.00 AM to 5.00 PM -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM

**૬૪૭-૭૬૧-૧૩૧૭**      [www.firstflightcanada.com](http://www.firstflightcanada.com)

**સ્વદેશ**  
CANADA

Registration # 869127209  
 Publication Mail Agreement /  
 Email : info@swadesh.news

Return Undeliverable Canadian Address To :

**Shree Balaji Inc.**  
**MAILING ADDRESS**  
 23 Lyric Road,  
 Brampton ON L6S 0B4.  
 416-996-7755

**Registered Address**  
 713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi  
 Director : Nilesh Tailor  
 Sub Editor : Chhaya Gandhi  
 Montreal Bureau : Vijay Patel (514-826-7442)

**GUJARAT OFFICE MAC AGENCIES** : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT ( INDIA)

Designed By  
 Sabir Daroga  
 Mevada Piyush  
 Firoz Shaikh





## બોલીવૂડ ક્યારેય ખતમ નહીં થાય: રોહિત શેટ્ટી

પુષ્પા અને કેલુએક જેવી સાઉથની ફિલ્મોને હિન્દી બેલ્ટમાં મળેલી સફળતા બાદ ઘણા લોકો બોલીવૂડના ભાવિ પર સવાલો ઉઠાવવા માંડ્યા છે. તેના પર બોલીવૂડના સુપર હિટ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પ્રતિક્રિયા આપી છે. એક ઈવેન્ટમાં તેમણે કહ્યું હતું કે, બોલીવૂડ ક્યારેય ખતમ નહીં થાય. તમે ઇતિહાસ જોઈ લો...50 અને 60ના દાયકામાં પ્યાર કિયે જા નામની રિમેક બની હતી. 80ના દાયકામાં અમિતાભ અને વિનોદ ખન્નાનું કેસ્ટિયર ટોપ પર હલુ ત્યારે કમલ હસનની એક દુબે કે લિયે હીટ... થઈ હતી.



# સ્પર્દેશ

FRIDAY, 03 JUNE, 2022

09

## તડપ તડપ કે... ના ગીતકાર કેકેના નિધનથી બોલિવુડમાં શોક

### દેશભરમાં કરોડો ચાહકોને આંચકો: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભવોએ શ્રદ્ધાંજલિ આપી

કોલકતા : 'હમ રહે યા ના રહે કલ', 'અલવિદા', 'અભી અભી તો મિલે હો' જેવા અનેક બ્લોકબસ્ટર ગીતના ગાયક બોલીવુડના પોપ્યુલર સિંગર કેકે એટલે કે, કૃષ્ણ કુમાર કુન્નથનું નિધન થઈ ગયું છે. સિંગર કેકેના આકસ્મિક નિધનથી બોલિવુડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. બોલિવુડના કલાકારો, નિર્માતાઓ, સંગીત નિર્દેશકો તથા ઈન્ડસ્ટ્રી સાથે સંકલ્પાયેલા લોકો દ્વારા કેકેને અંજલિનો પ્રવાહ દિવસભર ચાલતો રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના મહાનુભવોએ પણ કેકેનાં નિધન માટે દુઃખ વ્યક્ત

કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલિ આપતાં કહ્યું હતું કે કેકેના મોતથી પોતે ભારે ગમગીની અનુભવી રહ્યા છે. તેમણે અનેકવિધ મનોભાવ રજૂ કરતાં ગીતો સાથે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તેઓ તેમનાં ગીતો દ્વારા સદાય અમર રહેશે. ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી સહિતના રાજકીય મહાનુભવોએ પણ કેકેને અંજલિ આપી હતી. બોલિવુડના કલાકારો તથા સર્જકોએ પોતાના કેકે સાથે સંસ્મરણોને તાજાં કર્યાં હતાં. સંગીતકાર

વિશાલદેવલાણીએ કહ્યું હતું કે મારા માટે આંસુ રોકવાનું અશક્ય છે. સંગીતકાર અને ફિલ્મ ડિગ્રેશક વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે વર્ષો પહેલાં મેં અને કેકેએ દિલ્હીમાં એકસાથે શરુઆત કરી હતી. માર્ચિસ ફિલ્મ દ્વારા અમને બંનેને એકસાથે કામચાલી મળી હતી. છોડ આરે હમ વોહ ગલીયાં ગીત સાથે કેકેએ લત્તા મંગેશકરના પાની પાની રે ગીતના બીજા ભાગમાં પણ કંઠ આપ્યો હતો. મારા માટે એ નાના ભાઈ જેવો હતો. સંગીતકાર પ્રિતમ કહ્યું હતું કે કોઈ મને કહે તો સારું કે કેકેના મોતના સમાચાર ખોટા છે.


## માનહાની કેસમાં જોની ડેપે એમ્બર હર્ડને હરાવી



હોલીવુડ ફિલ્મ પાર્ટરટસ ઓફ ધ કેરેબિયન્સ ફિલ્મ અને સિરીઝમાં અભિનય કરનાર અને ત્રણ વખત ઓસ્કર-નોમિનેટ થયેલા અભિનેતા જોની ડેપે તેની ભૂતપૂર્વ પત્ની એમ્બર હર્ડ સામે માનહાનિનો દાવો જીત્યો છે. હોલીવુડ અભિનેતા જોની ડેપે અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડનો કોર્ટ કેસ છેલ્લા છ અઠવાડિયાથી ચર્ચામાં હતો. ચુકાદાના દિવસે એમ્બર હર્ડ વર્જિનિયા કોર્ટરૂમમાં હાજર હતી, જ્યારે જોની ડેપે ચુકાદાના દિવસે કોન્સર્ટના કારણે હાજર રહી શક્યો નહોતો. 58 વર્ષના જોની ડેપે તેની ભૂતપૂર્વ પત્ની અને અભિનેત્રી 36 વર્ષની એમ્બર હર્ડ પર કેસ કર્યો હતો. હકીકતમાં, 2018માં એમ્બરે વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં એક વિગતવાર લેખ લખ્યો હતો કે તે ઘરેલુ હિંસાનો શિકાર બની હતી, જોકે તેણે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ જોની ડેપે કહ્યું છે કે આ લેખ તેની બદનામી કરે છે અને તેનાથી તેની કારકિર્દી પર અસર પડી છે. આ પછી જોની ડેપે તેની પૂર્વ પત્ની સામે \$50 મિલિયનનો કેસ દાખલ કર્યો. બદલામાં, એમ્બરે \$100 મિલિયનનો કેસ પણ કર્યો.

## મુંબઈના વસોવા હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે કેકેના અંતિમ સંસ્કાર

બુધવારે મોડી રાત્રે કેકેની પત્ની અને તેના બન્ને બાળકો તેમના પાર્થિવ શરીરને લઈને મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન કેકેની એક ઝલક જોવા માટે તેમના ફેન્સની ભીડ તેમના એપાર્ટમેન્ટની બહાર જોવા મળી હતી. સિંગર કેકેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તેમના ઘર પર જ રાખવામાં આવ્યું હતું. જ્યાં મીડિયા અને તેમના ફેન્સ તેમના અંતિમ દર્શન કર્યા હતા. બપોરે લગભગ 1:00 વાગ્યા બાદ વસોવા હિન્દુ સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. જ્યાં ઈન્ડસ્ટ્રી, પરિવાર અને સામાન્ય લોકો પહોંચ્યા હતા.



## બોલિવુડ ગાયક કેકેને કોલકાતામાં ગન સેલ્યૂટ અપાઈ: રાજકીય સન્માન સાથે વિદાય

કોલકાતામાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિવંગત ગાયકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે કેકેનાં પત્ની જ્યોતિ કૃષ્ણા, પુત્ર નકુલ અને પુત્રી તમારા સહિત પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યાં હતાં. રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજી પણ કોલકાતાના રબીન્દ્ર સદન પહોંચ્યાં હતાં અને તેમણે કેકેને શ્રદ્ધાંજલિ આપી હતી. મમતાએ પરિવારના લોકો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી. દરમિયાન કેકેનાં મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. એવા અહેવાલો આવ્યા છે જેમાં ગરમીની ફરિયાદ અને ઇજાના નિશાનની વાત કહેવાઈ હતી. મીડિયા રિપોર્ટમાં કહેવાયું હતું કે ગાયકના માથા પર ઇજાનાં નિશાન હતાં, તો એક અન્ય રિપોર્ટમાં કહેવાયું હતું કે કેકેએ ગરમીની ફરિયાદ કરી હતી. પોલીસે કેકેનાં મોતની ઘટનામાં અસામાન્ય મોતનો કેસ દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે.

## જુગ જુગ જિયોની વાર્તાની ઉઠાંતરીનો મામલો સેન્સર બોર્ડમાં પહોંચ્યો



મુંબઈ : કરણ જોહરની ધર્મ પ્રોડક્શનની ફિલ્મ જુગ જુગ જિયોની મૂળ વાર્તાની ઉઠાંતરીનો મામલો સેન્સર બોર્ડમાં પહોંચ્યો છે. આ ફિલ્મ પોતાની મૂળ વાર્તા પરથી બની હોવાનો દાવો કરનારા ક્રિએટિવ પ્રોડ્યુસરે સેન્સર બોર્ડમાં ધા નાખી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ નહીં આપવા અપીલ કરી છે. તેમણે પોતે ફિલ્મની રિલીઝ અટકાવવા કાનૂની પગલાં પણ ભરી રહ્યા હોવાનું જણાવ્યું છે. કિયારા અડવાણી, વરુણ ધવન અને નીતુ સિંહ અને અનિલ કપૂરની ફિલ્મ જુગ જુગ જિયોની વાર્તા પોતાની મૂળ સ્ટોરી બત્રી રાની પરથી ઉઠાવવામાં આવી હોવાનો આક્ષેપ ક્રિએટિવ પ્રોડ્યુસર અને રાઈટર વિશાલ સિંહે કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર પોતે ૨૦૨૦માં આ વાર્તા સ્ક્રીનપ્લે રાઈટર એસોસિએશનમાં રજિસ્ટર કરાવી હતી અને પછી ફિલ્મ કો પ્રોડ્યુસર કરવા માટે ધર્મ પ્રોડક્શનને મોકલી હતી.

## સોનાલી બેન્દ્રેએ કબૂલ્યું ઘરભાડું કાઢવા કચરો ફિલ્મો કરી



મુંબઈ : ૯૦ના દાયકાની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કબૂલાત કરી છે કે તેણે પોતાની કારકિર્દીમાં બહુ કચરો ફિલ્મો કરી છે. પરંતુ તે સમયે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જે ફિલ્મો મળે તે કરી લેવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. સોનાલીને કેટલીય હિટ ફિલ્મો મળી તેના પર પિક્ચરાઈઝ થયેલાં કેટલાંય ગીતો આજે પણ લોકપ્રિય છે પરંતુ મોટાભાગની ફિલ્મોમાં તેણે બહુ મહત્વની ના હોય તેવી ભૂમિકાઓ કરી છે. કારકિર્દીની શરુઆતમાં જ બહુ યાદગાર ભૂમિકાઓ કેમ ના કરી તેવું એક મીડિયા સંવાદમાં પૂછાતાં સોનાલીએ કહ્યું હતું કે તેને પૈસાની જરુર હતી એટલા ખાતર થઈને તેણે એ બધી ભંગાર ફિલ્મો કરી હતી. સોનાલીના કહેવા અનુસાર મારે પૈસાની જરુર હતી. મારે ઘરનું ભાડું ભરવાનું હતું. મારે કેટલાંય બિલ ભરવાનાં હતાં. મારા પરિવારની આર્થિક સ્થિતિ તે વખતે બહુ સારી ન હતી. હું ઝડપથી પૈસા કમાઈ શકું એ માટે આ લાઈનમાં આવી હતી અને મારી પાસે સારા રોલ જ કરવા એવી કોઈ ચોઈસ જ ન હતી. સોનાલીએ એ દિવસો યાદ કરતાં કબૂલ્યું હતું કે કેટલીક વખત તો હું પોતે મનોમન મારી જાતને કોસતી હતી કે આ હું શું કરી રહી છું, પરંતુ, પછી ચેક આવવાનો છે એવું યાદ કરી તેમાં ઓતપ્રોત થઈ જતી હતી. સોનાલીએ નિખાલસ રીતે જણાવ્યું હતું કે મારી પોતાની કેટલીય ફિલ્મો મેં ખુદ જોઈ નથી કારણ કે એમાં કાંઈ જોવાલાયક હતું જ નહીં.



મુંબઈ : શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબી દ્વારા ક્લિનચીટ આપી દેવાયા બાદ રિયા ચક્રવર્તી સામે થયેલા એનસીબી કેસોમાં પણ ફેરતપાસની માંગ તેના વકીલે કરી છે.

જોકે આ માગણીથી સુશાંતના ચાહકો એટલા રોષે ભરાયા હતા કે તેમણે બોયકોટ બોલિવુડના ટ્રેન્ડ ચલાવી દીધો હતો. આર્યન ખાન સામે એનસીબીને કોઈ પુરાવા મળ્યા ન હતા. એનસીબીએ પોતે જ કરેલી કબૂલાત મુજબ આર્યન પાસે કોઈ ડ્રગ પણ મળ્યું ન હતું અને તેની વ્હોટસ એપ ચેટને સમર્થન આપે તેવા કોઈ ભૌતિક પુરાવા

## રિયા ચક્રવર્તી માટે ન્યાયની માગણી થતાં સુશાંતના ચાહકો નારાજ

પણ હાથ લાગ્યા ન હતા. એનસીબીએ સુશાંત કેસ બાદ રિયા ચક્રવર્તી સામે ત્રણ કેસ કર્યા હતા. તેને પગલે બોલિવુડ સ્ટાર્સની પરેડ એનસીબી ઓફિસમાં થઈ હતી. રિયાના વકીલ સતીશ માનશિંદેએ જ શરુઆતમાં આર્યન કેસમાં પણ દલીલો કરી હતી. હવે સતીશ માનશિંદેએ આર્યન કેસને પગલે રિયા ચક્રવર્તી સામેના કેસોમાં પણ ફેરતપાસની માગણી કરી હતી.



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

 માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!  
 રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

[www.swadesh.news](http://www.swadesh.news)

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

[info@swadesh.news](mailto:info@swadesh.news)

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

પંજાબમાં હરીફોને ખતમ કરવા ગાયકો દ્વારા ગોંગસ્ટારોની મદદ લેવાનો સિલસિલો

# મુસેવાલાની હત્યા : બે ગોંગની લડાઈ કારણભૂત

પંજાબી ગાયક સિધુ મુસાવાલાની હત્યા થતાં સમગ્ર પંજાબમાં સનસની મચી ગઈ, આ ઘટનાના કલાકોમાં જ દિલ્લી પોલીસે આ કેસમાં તિહાર જેલમાં રહેલા માફિયા ડોન લોરેન્સ બિશ્નોઈનો હાથ હોવાની શંકા સેવી છે. જેથી પંજાબ પોલીસે પણ લોરેન્સ બિશ્નોઈએ જેલમાં રહીને મુસાવાલાની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડ્યું? તે દીશામાં તપાસ આગળ વધારી છે.

સિધુ મુસાવાલાની હત્યા કેટલી કૂરતાપૂર્વક કરવામાં આવી હતી તેની ચોંકાવનારી વિગતો તેની ગાડીમાં જ બેઠેલા મિત્રએ આપી છે. સિધુ મહિન્દ્રા થાર જીપમાં બેસીને બરનાલામાં રહેતી તેની આન્ટીની મુલાકાત લેવા જતો હતો. આ સમયે તેની સાથે તેના બે મિત્રો ગુરવિન્દર સિંહ અને ગુરપ્રીત સિંહ પણ કારમાં હતા. ગુરવિન્દર સિંહે તો કારની પાછલી સીટમાં બેસીને આખો હુમલો જોયો હતો. જીપમાં બે સુરક્ષા કર્મચારીનો સમાવેશ થઈ શકે તેમ ન હોવાથી તેઓ પાછળની કારમાં આવતા હતા. તેના કહેવા મુજબ તેઓ જેવા બરનાલાની નજીક પહોંચ્યા કે તરત જીપ ઉપર સામેથી અંધાધૂંધ ગોળીબાર થઈ ગયો. આ સમયે આગળ એક કારે તેમનો રસ્તો રોકી લીધો હતો. જે બાદ એક માણસ જીપની સામે આવ્યો હતો અને તેણે ઓટોમેટિક એસોલ્ટ રાઈફલમાંથી ગોળીઓનો વરસાદ કર્યો. સિધુએ પણ પોતાની પિસ્તોલમાંથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો પણ હુમલાખોરો પાસે અદ્યતન હથિયારો હોવાથી તેનો ઝાઝો ફાયદો થયો નહીં.

ગુરવિન્દર સિંહના કહેવા મુજબ આશરે 8થી 10 હુમલાખોરો સિધુની જીપ આસપાસથી ગોળીબાર કર્યો ત્યારે સિધુએ ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો. તેના પર આશરે 30 ગોળીઓ છોડવામાં આવી હતી. આટલી ગોળીઓ છોડ્યા પછી પણ હત્યારાઓએ તપાસ કરી કે, સિધુ ખરેખર મરી ગયો છે કે કેમ? હુમલાખોરો બે કારમાં આવ્યા હતા. તેમાંની એક સેદાન હતી અને બીજી SUV હતી. હત્યા કરીને તરત હત્યારાઓ કાર હંકારી ભાગી છૂટ્યા હતા.

આમ તો મુસેવાલાની હત્યાની જવાબદારી કેનેડામાં રહેતા ગોંગસ્ટાર ગોલ્ડી બ્રારે લીધી છે, જે બિશ્નોઈ ગોંગનો સાગરીત હોવાનું માનવામાં આવે છે. મુસેવાલાની પંજાબી યુવકોમાં ભારે લોકપ્રિયતા છે પણ આ લોકપ્રિયતા અશ્લીલ ગીતોના કારણે છે. મુસેવાલા સામે અશ્લીલતા ફેલાવવાના બે કેસ નોંધાયેલા છે. મુસેવાલાને પંજાબના યુવકોમાં ગન કલ્ચરનો ફેલાવો કરવા માટે પણ જવાબદાર ગણવામાં આવે છે.



હવે મુસાવાલાની હત્યા માટે જેને જવાબદાર ગણાય છે તે બિશ્નોઈ ગોંગના બિશ્નોઈની સામે હત્યા અને હુમલા વસૂલી જેવા બે ડઝન કેસ નોંધાયેલા છે. મુસાવાલાની હત્યા બિશ્નોઈ ગોંગ અને દેવિન્દર બાંભિયા ગોંગ વચ્ચેની લડાઈને કારણે થઈ છે. દેવિન્દર બાંભિયાની 2016માં ગોંગ વોરમાં હત્યા થઈ હતી. જે બાદ તેની ગોંગનું સંચાલન લકી પતિયાલ કરી રહ્યો છે. હાલમાં તે આર્મેનિયાની જેલમાં કેદ છે. ભારતની તિહાર જેલ એશિયાની સૌથી મોટી જેલ છે. તેમાં આશરે 17, 500 કેદીઓ રહે છે. તેમાં રહેનારાને વધુમાં વધુ સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. તો પણ જેલમાં ક્યારેક ગોંગવોર ફાટી નીકળે છે.

તિહાર જેલમાં CCTV, કોમ્પ્યુટરાઈઝડ પ્રિઝનર મેનેજમેન્ટ સિસ્ટમ, મોબાઈલ જામર્સ, X-REY સ્કેનર્સ, મેટલ ડિટેક્ટર વગેરેનો ઉપયોગ

**પ્રાસંગિક**  
**ધવલ શુક્લ**

અકાલી યુવા નેતા વિકી મિદ્દુબેરાની હત્યા બાદ મુસેવાલા પર આક્ષેપો થતા રહ્યા, મુસેવાલાની હત્યાની જવાબદારી કેનેડામાં રહેતા અને બિશ્નોઈ ગોંગના કથિત સાગરિત ગોંગસ્ટાર ગોલ્ડી બ્રારે લીધી

કરવામાં આવે છે. તિહાર જેલમાં મોબાઈલ જામર્સ લગાડવામાં આવ્યા હોવા છતાં કેદીઓ મોબાઈલ એપનો ઉપયોગ કરીને પોતાના સાગરીતોના અને શિકારના પણ સંપર્કમાં રહેતા હોય છે. તિહાર જેલના કેદીઓ પાસેથી અનેકવાર વપરાયા હોય તેવા મોબાઈલ ફોન મળી આવે છે. પોલીસે શાહરૂખ નામના શકમંદની ધરપકડ કરી છે. જેણે મોબાઈલ એપનો ઉપયોગ કરીને તિહારમાં રહેલા



લોરેન્સ બિશ્નોઈની ગોલ્ડી બ્રાર સાથે કેનેડામાં વાત કરાવી હતી. સિધુ મુસાવાલાની હત્યામાં જે દેવિન્દર બાંભિયાની ગોંગનો હાથ હોવાનું મનાય છે, તેનું અસલી નામ દેવિન્દરસિંહ સિધુ હતું અને તે કબજીનો ખેલાડી હતો. તે ભણવામાં ડોશિયાર હતો. મોગા જિલ્લામાં આવેલા બાંભિયા ગામના કિસાન પરિવારનો નબીરો હતો અને શાર્પ શૂટર પણ હતો. 2010માં તે કોલેજમાં ભણી રહ્યો હતો, તે દરમિયાન બે જૂથો વચ્ચેની અદાવતમાં થયેલી હત્યામાં તેનું નામ બહાર આવતા તેને જેલમાં ધકેલી દેવાયો, જ્યાં તે ઘણા ગોંગસ્ટારોના સંપર્કમાં આવ્યો હતો અને ગુનાખોરીના પાઠો શીખ્યો હતો. 21 વર્ષની ઉંમરે તે જેલમાંથી છટકી ગયો અને પોતાની ગોંગ ઊભી કરી. જે બાદ 6 હત્યામાં તેની સંડોવણી હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે.

હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ખુદ તે પોતે જ સોશિયલ મીડિયા પર તેની માહિતી જાહેર

તેઓ પણ દેવિન્દરની જેમ પોતાની પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયા પર જાહેર કરે છે. હરિયાણામાં રહેલી કૌશલ ચૌધરીની ગોંગ દેવિન્દર ગોંગની ભાગીદારીમાં કામ કરે છે. તેમને હરિયાણામાં કોઈ હત્યા કરવી હોય તો તેઓ ચૌધરી ગોંગની મદદ માગે છે. દેવિન્દર ગોંગના સંચાલકોમાં આર્મેનિયાની જેલમાં રહેલા ગુંડા લકી ગૌરવ ઉપરાંત સંગરુર જેલમાં રહેલા સુખપ્રીત સિંહ બુડાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જલંધરમાં ઈન્ટરનેશનલ કબજી ખેલાડી સંદીપ સિંહની હત્યા થઈ, તેમાં પણ દેવિન્દર બાંભિયા ગોંગનો હાથ હતો. બિશ્નોઈ અને બાંભિયા ગોંગ વચ્ચેની દુશ્મનાવટ બહુ જૂની છે. પંજાબના જે લોકગાયકો છે, તેમની વચ્ચેની હરીફાઈ થતી રહે છે અને તેને કારણે જ અદાવતમાં વાત હત્યા સુધી પહોંચે છે. ગયા વર્ષે મોહાલીમાં જેની હત્યા થઈ હતી તે અકાલી નેતા સુખપ્રીત મિદ્દુબેરા પણ સંગીત ઉદ્યોગ સાથે સંકળાયેલ હતા.

હવે સિધુ મુસાવાલાની હત્યા અકાલી યુવા નેતા વિકી મિદ્દુબેરાની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવી હોવાની દ્રઢ આશંકા છે. વિકી મિદ્દુબેરા બિશ્નોઈ ગોંગ સાથે જોડાયેલો હતો. તેની હત્યા સિધુ મુસાવાલાએ કરાવી હોવાના આરોપો મુકાતા રહ્યા છે. સિધુ મુસાવાલાએ તેની સુપારી બાંભિયા ગોંગને આપી હોવાની ચર્ચા છે. હકીકતમાં બિશ્નોઈ ગોંગ એ બાંભિયા ગોંગની દુશ્મન હોવાથી સિધુની સુપારી બિશ્નોઈ ગોંગને આપવામાં આવી હતી. જો કે, બિશ્નોઈ ગોંગના ગુંડાઓ કહે છે કે મુસાવાલાની હત્યામાં તેમનો હાથ નથી. પણ તેમાં તેમનું નામ જાણીજોઈને લેવાઈ રહ્યું હોવાથી તેઓ બદલો લેશે, આવી જાહેરાત પણ તેમણે સોશિયલ મીડિયાની પોસ્ટ મારફતે કરી છે. બીજી તરફ સિધુ મુસાવાલાના સાથીદારોનું માનવું કે તેનો સંબંધ બાંભિયા ગોંગ સાથે હોવાથી તેની હત્યાના આગલા દિવસે જ તેની સિક્કોરિટીમાં ઘટાડો કરી દેવાયો હતો. બાંભિયા ગોંગના આક્ષેપ મુજબ મનકિરાત ઔલખ નામનો ગાયક બિશ્નોઈ ગોંગની નજીક હોવાથી તેની સુરક્ષા ઘટાડી નાખવામાં આવી નહોતી. નોઈડાની નીરજ બવાના ગોંગ પણ સિધુ મુસાવાલાના ટેકામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે કે, તેઓ બે દિવસમાં મુસાવાલાની હત્યાનો બદલો લેશે. આ ઉપરાંત પંજાબમાં થયેલા સત્તા પરિવર્તન સાથે પણ સિધુ મુસાવાલાની હત્યાનો સંબંધ છે. પંજાબમાં 'આપ'ની સરકાર બની કે તરત 424 ઈસમોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી કે ઘટાડી નંખાઈ હતી. તે પૈકી સિધુની સુરક્ષા પણ ઘટી હતી.

# માનુનીઓને લાંબા સમય સુધી મધમઘતા રાખતા પરફ્યૂમ

પ્રસંગોપાત ઉપયોગમાં લેવાતાં પરફ્યૂમે હવે મહિલાઓના વોર્ડરોબમાં સ્થાન જમાવી લીધું છે. કૉલેજગોઇંગ ગર્લ હોય કે વર્કિંગ વુમન દરેકના પર્સમાં સ્મોલ સાઇઝ પરફ્યૂમ હોટ ફેવરિટ બની ગયાં છે. સામાન્ય રીતે પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા પણ ઘણા લોકો પરફ્યૂમનો ઉપયોગ કરે છે. આમ એક પરફ્યૂમ અનેક રીતે ઉપયોગી છે. તમને દીવાના બનાવી દે એવી માદક સુગંધનાં પરફ્યૂમ બજારમાં ઉપલબ્ધ છે. જ્યારે તમે પરફ્યૂમ ખરીદવા જાવ ત્યારે તેની સુગંધથી તમને કોઈ પ્રકારની એલર્જી તો નથી થતીને એ સૌથી પહેલાં ચકાસી લો. પરફ્યૂમ વિશે જો તમને ખાસ કંઈ માહિતી ન હોય તો તેને મેળવવાના અનેક વિકલ્પ છે જે તમને ઘણી વખત કન્ફ્યૂઝ કરી દે છે. તેથી પરફ્યૂમ ખરીદતી વખતે અમુક વાતનું ધ્યાન રાખો.



## પરફ્યૂમની પરખ

કોઈપણ પરફ્યૂમને પારખવા માટે સૌથી પહેલાં તમે કોઈ સ્ટ્રીપ પર છાંટીને સૂંઘો. એ પછી તમારા બોડી પર લગાવીને ટ્રાય કરો. જો તેની સુગંધ પાંચથી દસ મિનિટ સુધી ટકી રહે છે તો સમજો કે આ પરફ્યૂમ યોગ્ય છે.

## લોન્ગ લાસ્ટિંગ

અગણિત ફ્લેવર અને કંપનીઓનાં પરફ્યૂમ સરળતાથી બજારમાં મળી રહે છે. એમાંથી ઘણાં પરફ્યૂમ એવાં હોય છે જેની સુગંધ લોન્ગ લાસ્ટિંગ હોતી નથી એટલે કે પરફ્યૂમ લગાવ્યાને બે-ત્રણ કલાકમાં સુગંધ ઊડી જાય છે. આવું ન થાય એટલે તમને જે પરફ્યૂમ પસંદ આવે તેની બોટલ પર જ્યાં લેબલ લગાવેલું હોય છે ત્યાં ઈડીપી અને ઈડીટી જેવા બે ટર્મ લખેલા હોય છે. લોન્ગ લાસ્ટિંગ સુગંધ માટે ઈડીપીવાળા પરફ્યૂમનો વિકલ્પ બેસ્ટ છે.

## બોડી પોઇન્ટ્સ પર કરો ટ્રાય

સામાન્ય રીતે પરફ્યૂમની ફેગરન્સને આપણે હાથ પર છાંટીને ટ્રાય કરતાં હોઈએ છીએ. તમે એને આંગળી અને હથેળી પર અજમાવી શકો છો. ઘણી યુવતીઓ પરફ્યૂમની સરસ મજાની બોટલને જોઈને પરફ્યૂમ ખરીદી લેતી હોય છે. આમ કરવાને

બદલે પરફ્યૂમની ફેગરન્સને કાંડા, આંગળી કે પછી હથેળી ઉપર અજમાવ્યા બાદ જ ખરીદો.

## પરફ્યૂમની સુગંધ

તમારી પર્સનાલિટીમાં પરફ્યૂમની સુગંધ બહુ મોટો ભાગ ભજવે છે તેથી પરફ્યૂમ ખરીદતી વખતે તેની સુગંધ ઉપર ખાસ ધ્યાન આપો. તેની સ્ટ્રોંગ સુગંધથી ઈરિટેશન થતું હોય તો એવું પરફ્યૂમ ક્યારેય ન ખરીદો. માઈલ્ડ અને મીઠી સુગંધનો અહેસાસ કરાવે એવાં પરફ્યૂમની પસંદગી કરો.

## પરફ્યૂમ લગાવવાની રીત

પરફ્યૂમને જો યોગ્ય જગ્યા પર લગાવવામાં આવે તો તેની સુગંધ લાંબા સમય સુધી ટકે છે. ઘણાં લોકો પરફ્યૂમને કાંડા પર લગાવે છે પણ તેને કોણીની અંદર લગાવવામાં આવે તો લાંબા સમય સુધી ટકે છે, કારણ કે કોણીની અંદર ગરમી ઉત્પન્ન થાય છે. જેથી પરફ્યૂમ લાંબા સમય સુધી ટકે છે. કાનની પાછળ પણ તમે પરફ્યૂમ લગાવી શકો. આ એવું સ્પોટ છે જે ઓઈલી હોય છે, તેથી ત્યાંથી પરફ્યૂમ જલદી ઊડતું નથી. એવી રીતે બીજો સ્પોટ નાભિ છે. આ શરીરનો એવો ભાગ છે જ્યાંથી હીટ નીકળે છે. જે પરફ્યૂમ લગાવવા માટે પરફેક્ટ પોઈન્ટ છે.

# ઓન-ડિવાઈસ ફોડ માટે એન્ડ્રોઈડ ઉપકરણ સરળ માર્ગ


2022 માં મોબાઈલ ગ્રેટ લેન્ડસ્કેપનું વિશ્લેષણ દર્શાવે છે કે સૌથી વધુ માલવેર એટેક્સ સ્પેન અને તુર્કી પર થયા છે. નવા અને હાલના બેંકિંગ ટ્રોજનનું મિશ્રણ ઓન-ડિવાઈસ ફોડ (ODF) કરવા માટે Android ઉપકરણોને વધુને વધુ લક્ષ્ય બનાવી રહ્યા છે. અન્ય લક્ષિત દેશોમાં પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુ.એસ., જર્મની, યુ.કે., ઈટાલી, ફ્રાન્સ અને પોર્ટુગલનો સમાવેશ થાય છે. ડચ સાયબર સિક્યુરીટી કંપની ગ્રેટેક્સિક જણાવે છે કે ODF એ સૌથી વધુ ચિંતાજનક વિષય છે.

માત્ર 2022 ના પ્રથમ પાંચ મહિનામાં જ ડિવાઈસ ઉપયોગ કરીને છેતરપિંડી કરવા માટે Android OS નો દુરુપયોગ કરતા માલવેર ફ્લેવરમાં 40% થી વધુનો વધારો થયો છે. જે પરંપરાગત છેતરપિંડી સ્કોરિંગ એન્જિનનો ઉપયોગ કરીને તેમને શોધવાનું લગભગ અશક્ય બનાવે છે. Hydra, FluBot (aka Cabassous), Cerberus, Octo, and ERMAC એ સમાન સમયગાળા દરમિયાન જોવા મળેલા નમૂનાઓની સંખ્યાના આધારે સૌથી વધુ સક્રિય બેંકિંગ ટ્રોજન માટે જવાબદાર છે. Google Play Store પર નવી ડ્રોપર એપ્લિકેશન્સની સતત શોધ કરવામાં આવે છે. જે માલવેર યુક્ત એપ્લિકેશનના નિર્માણકર્તા અને ઉપયોગકર્તા બન્ને પર નજર રાખે છે. વધુમાં ખામીયુક્ત એપ્લિકેશનને Google Play Store દ્વારા વારંવાર દુર કરવામાં આવે છે. ગત અઠવાડિયામાં Google Play Store પરથી દુર કરવામાં આવેલી એપ્લિકેશનની યાદી નીચે મુજબ છે.

■ Nano Cleaner (com.casualplay.leadbro) ■ QuickScan (com.zynksoftware.docuscanapp) ■ Chrome (com.talkleadhr) ■ Play Store (com.girltold85) ■ Pocket Screencaster (com.cutthousandjs) ■ Chrome (com.biyitunixiko.populolo) ■ Chrome (Mobile com.xifoforezuma.kebo) ■ BAWAG PSK Security (com.qjlpfydjb.bpcogkzm)

ODFએ શું છે? ODFએ પીડિતોના ડિવાઈસમાંથી બોગસ વ્યવહારો શરૂ કરવાની એક છુપી પદ્ધતિનો સંદર્ભ આપે છે. તેણે બેંકિંગ એપ્લિકેશન્સમાં લોગિન કરવા અને નાણાકીય વ્યવહારો કરવા માટે

અગાઉ ચોરી કરેલા ઓળખપત્રોનો ઉપયોગ કરવાનું શક્ય બનાવ્યું છે. બાબતોને વધુ ખરાબ કરવા માટે બેંકિંગ ટ્રોજન પણ તેમની ક્ષમતાઓને સતત અપડેટ કરતા જોવામાં આવ્યા છે, ઓક્ટો સબમિટ થાય તે પહેલાં જ ઓવરલે સ્ક્રીનમાંથી ઓળખપત્ર ચોરી કરવા



માટે એક સુધારેલી પદ્ધતિ ઘડી રહ્યા છે. સંશોધકોએ સમજાવ્યું કે જો કંઈક શંકાસ્પદ હોય અને ઓવરલે પેજમાં હાજર ફિશિંગ લોગિનને વાસ્તવમાં એન્ટર થયા વિના ઓવરલે બંધ કરે તો પણ ઓળખપત્રો મેળવવામાં સક્ષમ થવા માટે આવું કરવામાં આવે છે. ERMAC, જે ગયા સપ્ટેમ્બરમાં ઉભરી આવ્યું હતું, તેને તેના પોતાના નોંધપાત્ર સુધારાઓ પ્રાપ્ત થયા છે જે તેને Androidની એક્સેસિબિલિટી સેવાનો લાભ લઈને સ્વયંસંચાલિત ફેશનમાં વિવિધ ક્રિપ્ટોકરન્સી વોલેટ એપ્લિકેશન્સમાંથી સીડ શબ્દસમૂહો બનાવવાની મંજૂરી આપે છે.

તાજેતરના વર્ષોમાં એક્સેસિબિલિટી સર્વિસ એ એન્ડ્રોઈડની હીલ સર્વીસ રહી છે. જે જોખમી માલવેરને નક્કી ઓવરલે સ્ક્રીનો સાથે અસંદિગ્ધ યુઝર્સને સેવા આપવા અને સંવેદનશીલ માહિતી મેળવવા માટે કાયદેસર APIનો લાભ લેવાની મંજૂરી આપે છે. ગયા વર્ષે Google એ સુનિશ્ચિત કરીને સમસ્યાનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો કે માત્ર એવી સેવાઓ કે જે વિકલાંગ લોકોને તેમના ડિવાઈસને એક્સેસ કરવામાં મદદ કરવા અથવા અન્યથા તેમની વિકલાંગતામાંથી ઉદ્ધવતા પડકારોને દૂર કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે તે જાહેર કરવાને પાત્ર છે કે તેઓ સુલભતા સાધનો છે.

ટેક જાયન્ટ એન્ડ્રોઈડ 13 એક ડગલું આગળ જઈ રહ્યું છે. જે હાલમાં બીટા સ્વરૂપમાં છે અને યુઝર્સએ એપ સ્ટોરની હહારથી સાઈડલોડ

કરેલી એપ્સ માટે API એક્સેસને પ્રતિબંધિત કરીને, સંભવિત રૂપે નુકસાનકારક એપ્સ માટે સેવાનો દુરુપયોગ કરવાનું અસરકારક રીતે મુશ્કેલ બનાવે છે. બાયપાસ કરેલ ઈન્સ્ટોલેશન પ્રક્રિયા દ્વારા આ પ્રતિબંધોને નજીવી રીતે બાયપાસ કરવામાં સક્ષમ છે. જે આવા જોખમોનો સામનો કરવા માટે વધુ કડક અભિગમની જરૂરિયાત સૂચવે છે.

એવી ભલામણ કરવામાં આવે છે કે યુઝર્સ Google Play Store પરથી જ એપ્સ ડાઉનલોડ કરે. એવી એપ્સને અસામાન્ય પરવાનગીઓ આપવાનું ટાળે કે જેની પાસે તેમના માટે પૂછવાનો કોઈ હેતુ નથી (દા.ત. સંપર્ક સૂચિને એક્સેસ કરવા માટે પૂછતી કેલ્ક્યુલેટર એપ્લિકેશન) અને ઈન્સ્ટોલ કરવાના હેતુથી કોઈપણ ફિશિંગ પ્રયાસોથી સાવચેત રહો.

Android OSની નિખાલસતા સારી અને ખરાબ બંને રીતે સેવા આપે છે. કારણ કે માલવેર કાયદેસર સુવિધાઓનો દુરુપયોગ કરવાનું ચાલુ રાખે છે. જ્યારે આગામી પ્રતિબંધો આવી એપ્લિકેશનોના દૂષિત ઈરાદાઓમાં ભાગ્યે જ દખલ કરે છે.

beinghumanmj

**શીર્ષક :**  
**શીતળતાનું સરનામું**  
**કવચિત્રી :**  
**હિના મોદી**

પોસ્ટમેને પૂછ્યું-  
'ફલાણું સરનામું ક્યાં?'  
મેં આંગળી ચીંધી  
ને,  
આવી બેઠું મારી આગળી પર  
પરસેવે રેબઝેબ એક સૂચકિરણ.  
પછી;  
ધીરેથી,  
એણે મને પૂછ્યું -  
'શીતળતાનું સરનામું ક્યાં??'

## SHIV FINANCIAL SERVICES

Serving Community Since 2009  
Canada

**BEST RATES AVAILABLE**

**FREE PERSONAL TAX-FILE FOR NEW IMMIGRANTS**

**SUPER VISA MEDICAL INSURANCE & VISITOR TO CANADA MEDICAL INSURANCE**

**JAGDISHBHAI SEVAK**  
Insurance Broker

**647-236-7620**

sevak\_2007@hotmail.com • www.shivfinancialservices.ca  
"PROPER INSURANCE COVERAGE IS PEACE OF MIND"

# આઠ વર્ષમાં એક પણ ખોટું કામ નહીં : મોદી

રાજકોટ

આઠ વર્ષ પહેલા ગુજરાતે મને વિદાય આપી હતી, પણ પ્રેમ વધતો જાય છે, પુ.ગાંધી બાપુ અને સરદાર પટેલની આ ધરતીમાં મને જે શિક્ષણ, સંસ્કાર મળ્યા છે તેના કારણે આઠ વર્ષથી દેશની સેવામાં કોઈ કસર છોડી નથી, એક પણ ખોટું કામ કર્યું નથી અને કરવા દીધું નથી, ગરીબોના કલ્યાણ અને સુશાસનને જ પ્રાથમિકતા આપી છે તેમ આજે જસદણ તાલુકાના આટકોટમાં પટેલ સેવા સમાજ ટ્રસ્ટની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિહ્નકાર જનમેદનીને સંબોધનમાં જણાવ્યું હતું.

રાજકોટથી 52 કિ.મી. દૂર ભાવનગર હાઈવે પર નાનકડા



આટકોટમાં વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સેંકડો મહિલાઓએ કળશ અને કેસરી રંગની સાડી પરિધાન કરીને કરેલા સન્માનથી ભાવવિભોર મોદીએ જન સમુદાયને વંદન કરીને ધોમધખતા તાપમાં આશિર્વાદ દેવા આવ્યા છો તેમ કહી ધન્યવાદ આપ્યા હતા.

તેમણે કહ્યું કે દરેક નાગરિકને નાતજાત, સગાવાદના ભેદભાવ કે ભ્રષ્ટાચાર વગર જે હક્કદાર છે તે તમામને 100 ટકા યોજનાનો લાભ મળે તે માટે સરકાર અભિયાન ચલાવી રહી છે. કોરોના કાળમાં દેશની જનતાના આરોગ્યની ચિંતા કરીને ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટથી માંડીને તમામને મફત વેક્સીન આપી છે. દેશમાં 3 કરોડ ગરીબ પરિવારોને ઘરનું ઘર, 10 કરોડને શૌચાલયો, 9 કરોડને ધુમાડાથી મુક્તિ માટે ગેસ સિલિન્ડર, 6 કરોડને નળથી જળ, ૨.૫૦ કરોડને વિજળી આપી એ માત્ર આંકડા નથી પરંતુ, ગરીબોની સેવા માટે અમારી કટિબદ્ધતા છે. આયુષ્યમાન કાર્ડ દુનિયાની સૌથી મોટી યોજના છે.

## આટકોટ ખાતે PM મોદીના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટ ખાતે નવ-નિર્મિત માતૃશ્રી કેડીપી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને આવકાર્યા હતા અને તેમને સુશાસનના પ્રણેતા ગણાવ્યા હતા. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય સેવા માટે ઉપયોગી બનશે. રાજકોટમાં બનેલી આધુનિક હોસ્પિટલ લોકો માટે લાભદાયી બનશે.

## બોટાદ પાલિકા પ્રમુખની ચૂંટણીમાં બળવો, BJPના 19 સભ્ય દ્વારા મેન્ડેટ વિરુદ્ધ મતદાન

બળવાખોર ઉમેદવારને 23 મત મળ્યા : કોંગ્રેસનાં ચાર સભ્યે મત આપતા બળવાખોર ઉમેદવાર પ્રમુખ બન્યા



બરવાળા

બોટાદ નગરપાલિકામાં ભાજપનાં સભ્યોમાં લાંબા સમયથી ડખો ચાલી રહ્યો છે, જેના પગલે મંગળવારે બોટાદ નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણીમાં ભાજપના કેટલાક સભ્યોએ બળવો કરતા ભાજપનાં ઉમેદવારનો પરાજય થયો હતો. કોંગ્રેસના સભ્યોએ પણ બળવાખોર ઉમેદવારને મત આપતા તેઓ પ્રમુખ બન્યા હતા.

બોટાદ નગરપાલિકાની ગત ચૂંટણીમાં બોટાદ નગરની જનતાએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપી શાસન અને વિકાસ કરવા માટેની ધૂરા સોંપી હતી. બોટાદ નગરપાલિકામાં કુલ ૪૪ સભ્યોમાંથી ૪૦ સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં ચુંટાયા છે. છેલ્લા ઘણા સમયથી બોટાદ નગરપાલિકાને

જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક વિવાદ સામે આવી રહ્યાં છે અને જૂથ બંધીને કારણે બોટાદ નગરનાં વિકાસની ગતિને બ્રેક લાગી ગઈ છે. એક માસ અગાઉ બોટાદ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી સમિતિનાં હોદ્દેદારો સામે સભ્યોએ ફરિયાદ કરતા જલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિનાં ચેરમેનને રાજીનામું આપ્યું નહોતું અને તમામ ચેરમેનોનાં રાજીનામાનો પણ અસ્વીકાર કર્યો હતો એટલે પ્રદેશ ભાજપનાં આગેવાનોએ મધ્યસ્થી કરી પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી સમિતિનાં ચેરમેનનાં રાજીનામા લઈ લીધા હતા અને પ્રમુખની ખુરશી ખાલી પડી હતી.

## દરિયાઈ માર્ગે મુંબઈના દ્વાર ખુલશે, ટૂંક સમયમાં રો-પેક્સ સર્વિસ શરૂ કરાશે

ભાવનગર

ભાવનગરનું હજીરા (સુરત) સાથે જળસીમાથી કનેક્શન મળ્યા બાદ આગામી ટૂંક સમયમાં દરિયાઈ માર્ગે મુંબઈના દ્વાર પણ ખુલી જશે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસને વિસ્તારવાનું આયોજન કરાયું છે. આ માટે ૧૧૫ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ જહાજની ખરીદી થઈ ચુકી છે અને આ વહેસલ હજીરા ખાતે આવી ગયું છે. ભાવનગર-હજીરા વચ્ચે ચાલી રહેલી રો-પેક્સ ફેરી સર્વિસને મુંબઈ સુધી લંબાવવા માટે કેન્દ્ર સરકારે આયોજન કર્યું છે. જળ પરિવહન માગને વિકસાવવાના હેતુથી મુંબઈ રો-પેક્સ ફેરી સેવા શરૂ કરવા તૈયારીઓ થઈ રહી છે.

### સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

## માલધારી સમાજને સ્પર્શતી સમસ્યા અંગે રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ

પાલિતાણા

વડોદરા ખાતે તંત્ર દ્વારા તાજેતરમાં માલધારીઓ દ્વારા ઘરઆંગણે બાંધેલા પશુઓને લઈ જઈ પશુપાલકોને પરેશાન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર માલધારી સમાજને સ્પર્શતા કાયદાઓ રદ કરવાની માંગ સાથે ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા અપાયેલા રાજ્યવ્યાપી આંદોલન થવાના અંધાણ છે. મંગળવારે ભાવનગર જિલ્લામાં પાલિતાણા સહિતના તાલુકા મથકોમાં સ્થાનિક

માલધારી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવા સહિતની આંદોલનાત્મક કાર્યવાહીઓ હાથ ધરાઈ રહી છે. ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા માલધારી સમાજને સ્પર્શતા અનેકવિધ પ્રશ્નો અને તેઓની સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે તેમજ લાયસન્સ પ્રથા સહિતના કાળા કાયદાઓ રદ કરવાની બુલંદ માંગ સાથે ગુજરાતભરના માલધારીઓ ઠેર-ઠેર ફરી લડત કરી રહ્યા છે.

## જસદણમાં સગા પુત્રે જ ભાઈ-ભાભી અને પિતા પર લાકડા-દાંતરડાથી હુમલો કરાવ્યો

પિતા-પુત્ર અને પુત્રવધૂ સારવાર હેઠળ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો

જસદણ

જસદણ તાલુકાના વડોદ ગામે સગા ભાઈએ ગઢડાથી સગાઓને બોલાવી પિતા, ભાઈ, ભાઈના પત્ની પર હુમલો કરાવ્યો હતો. શાર્દુલ અને રાવત બન્ને સગા ભાઈઓ છે. અને બન્ને આસપાસમાં રહે છે. રાવત અને ચંદુ લીબાં ખાવડિયા શાર્દુલના ઘર પાસે મહિલાઓના ઔચિત્યનો ભંગ થાય એવી ગાળો બોલતા હતા. આથી રાવતના ભાઈ શાર્દુલે ગાળો બોલવાની ના પાડી હતી. જે તે સમયે બન્ને જુદા

પડીને ચાલ્યા ગયા હતા આ વખતે રાવતે એમના ભાઈ શાર્દુલને કહ્યું હતું કે આ અમારો મામલો છે. ઘરે ગયા પછી રાવતે ગઢડા ફોન કરીને એમના સગાઓને હથિયાર સાથે વડોદ આવી જવા કહ્યું હતું. એ મુજબ ગઢડાથી મહિલાઓ સહિત ચાર શખ્સો હથિયાર સાથે વડોદ આવી ગયા હતા. આ ચાર ઉપરાંત રાવત, રાવતના પત્ની અને ચંદુ લીબા મળી કુલ સાત શખ્સોએ શાર્દુલના ઘરે આવીને ગાળો ભાંડવા લાગ્યા હતા. આ સમયે રાવતને એમના

પિતા રવજીભાઈ ચારોલાએ તેને સમજાવવા અને ગાળો ન બોલવા કહેતા એ અટક્યા ન હતા. અને ગઢડાથી આવેલા ભૂરા કેશુ વાઘેલા, અને અને એનો ભાઈ નકુ કેશુ વાઘેલાએ શાર્દુલ પર પાઈપથી હુમલો કરી દીધો હતો. જેથી શાર્દુલ ગંભીર રીતે ઘવાયો હતો. એજ સમયે નકુ કેશુની પત્ની, ચંદુ કેશુ વાઘેલા, રાવત, રાવતની પત્ની ગીતા, ભુરા કેશુ વાઘેલા, નકુ કેશુ વાઘેલા, નકુની પત્ની, તથા ચંદુ લીબા વાઘેલાએ પણ સામુદાયિક હુમલો કરી દીધો હતો.

## ઠાસરામાં ભતિયા વિદ્યાર્થી દર્શાવી શિક્ષક દંપતિને સમાવવાનું કૌભાંડ

મહેકમમાં ભૂલ હોવાનું જણાવી 90 ને બદલે 91 વિદ્યાર્થી ચોપડે દર્શાવાયા : ડિસે. 2021માં ફરી સંખ્યા 90 કરી દીધી

નડિયાદ

ઠાસરા તાલુકાના સીમલજ ગામની પ્રાથમિક શાળામાં ખોટા વિદ્યાર્થીઓ દાખલ કરવામાં આવ્યા હોવાની આશંકાએ જોર પકડ્યું છે. ઓગષ્ટના મહેકમમાં ૯૦ને બદલે ૯૧ વિદ્યાર્થી ઓ હોવાનો સુધારો કર્યો હતો. પરંતુ બે મહિના બાદ વિદ્યાર્થીઓ ૯૦ થઈ ગયા હતા. બદલી કેમ્પ દરમ્યાન વધ પડેલા દંપતિ માટે ભૂતિયા વિદ્યાર્થીઓ દાખલ કરી નવી ભરતી કરવાનો

આશય બહાર આવ્યો છે. આ માટે જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ફરિયાદ થઈ હતી. પરંતુ જવાબદારો સામે પગલાં ભરવાને બદલે જિલ્લા કચેરીએથી એક વધુ શિક્ષક ફાળવી અપાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તો વળી આ શાળામાં ખોટી રીતે વધારાના શિક્ષક ફાળવીને જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગની શંકાસ્પદ ચુપકીટી સામે આંગળી ચિંધાઈ છે.

## સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઈકો સિસ્ટમને મજબૂત બનાવશે

અમદાવાદ

નારણપુરાના વરદાન ટાવર પાસેના પ્લોટમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખાતમુહૂર્ત સમયે કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગુજરાત અને દેશની સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમને મજબૂત બનાવશે. દેશનું સ્પોર્ટ્સ બજેટ આજે ત્રણ હજાર કરોડ ઉપર પહોંચ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણનો લાભ લાખો રમતવીરોને થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી ત્રીસ મહિનામાં પુરી કરી લેવાશે.

## ગુજરાતમાં કોરોનાના કુલ કેસો પૈકી 65 ટકા એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં

અમદાવાદ

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૪ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ ૨૪માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. અત્યારસુધી કુલ ૧૨,૧૩,૯૯૭ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૯.૦૯% છે. રાજ્યમાં હાલ ૨૧૬ એક્ટિવ કેસ છે. અમદાવાદમાંથી સૌથી વધુ ૧૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે. આમ, ૬૫ ટકા એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાંથી છે. વડોદરામાંથી ૩૮, સુરતમાંથી ૭, રાજકોટમાંથી ૫ એક્ટિવ કેસ છે. સોમવારે વધુ ૨૫૪૭૭ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. કુલ વેક્સિનેશન ડોઝ હવે ૧૦.૯૯ કરોડ છે.



# ઘુસણખોરોની વિરુદ્ધ ભારતનો વિજય થયો : રામ મંદિર મુદ્દે યોગીનું નિવેદન

યોગીએ રામ મંદિર ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યું, મહાસચિવ સહિત 250 સંતો ઉપસ્થિત અયોધ્યા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. અને તે બીજા તબક્કામાં પહોંચી ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહની પ્રથમ ઈંટ રાખી હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ૫૦૦ વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. આ સમય ઘુસણખોરોની સામે વિજયનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ ૨૦૨૦માં રામ મંદિરનો શિલાન્યાસ નાખ્યો હતો. જ્યારે બુધવારે મંદિરનું શિલા પુજન કરવામાં આવ્યું હતું. જે સાથે જ રામ મંદિર નિર્માણના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ હતી. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ભારત માટે આ અત્યંત મહાન ક્ષણ છે. ભારતે ઘુસણખોરોની સામે જીત મેળવી લીધી છે. રામ મંદિર લોકોની શ્રદ્ધાનું પ્રતિક



બનશે. આ શ્રદ્ધા પર ઘુસણખોરોએ હુમલો કર્યો હતો. અને અંતમાં ભારતનો આ ઘુસણખોરોની સામે વિજય થયો છે. ફરી એક વખત સત્યની જીત થઈ છે. આ વિજય ધર્મ, સત્ય અને ન્યાયના રસ્તે પ્રાપ્ત કરવામાં આવ્યો છે.

# બેંગાલુરુમાં ચાલુ કોન્ફરન્સે ટિકેટ પર શાહી ફેંકાઈ, ૩ની અટકાયત

બેંગાલુરુ

કર્ણાટકમાં ખેડૂત નેતા રાકેશ ટિકેટ પર શરૂ કોન્ફરન્સમાં શાહી ફેંકવામાં આવી હતી, જેને પગલે રાકેશ ટિકેટના સમર્થકોએ આ શાહી ફેંકનારાની સ્થળ પર જ મારપીટ કરી દીધી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ત્રણ લોકોની અટકાયત કરી છે. જ્યારે ટિકેટે આરોપ લગાવ્યો હતો કે પોલીસે મને સુરક્ષા ન આપી, સરકારના કાવતરાના ભાગરુપે મારા પર શાહી ફેંકવામાં આવી હતી. બેંગાલુરુમાં આવેલા ગાંધી ભવન ખાતે રાકેશ

ટિકેટ જ્યારે પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક શખ્સે તેમના પર શાહી ફેંકી દીધી હતી. જેને પગલે મારપીટ થઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ રાજ્યના ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા યોજવામાં આવી હતી. રાકેશ ટિકેટ પર આ શાહી ત્યારે ફેંકવામાં આવી જ્યારે તેઓ કર્ણાટકના ખેડૂત નેતા કોડિહાલી ચંદ્રશેખર અંગે વાત કરી રહ્યા હતા. ચંદ્રશેખર સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. રાકેશ ટિકેટે કહ્યું હતું કે મારે ચંદ્રશેખર સાથે કંઈ જ લેવાદેવા નથી.



# રશિયા પાસેથી સસ્તામાં ફૂડ ખરીદા પછી ભારતે હવે ખાતરનો સોદો કર્યો

ભારત ખાતરની ખરીદીના બદલામાં રશિયાને ચા, ઉધોગો માટે કાચો માલ, મેડિકલ ઉત્પાદનો, ઓટો પાર્ટ્સ આપશે

નવી દિલ્હી

યુકેન પર હુમલાને કારણે અમેરિકા, બ્રિટન પછી યુરોપીયન સંઘે રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યા છે. આ સાથે અમેરિકા વિશ્વના અન્ય દેશોને રશિયા સાથે વેપાર કરવા અંગે ચેતવણી આપી છે. જોકે, અમેરિકાની ધમકીઓ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તું ફૂડ ખરીદ્યું છે અને હવે ભારતે રશિયા પાસેથી ખાતરની ખરીદી માટે સોદો કર્યો છે. બીજીબાજુ ફૂડની આયાત પર જંગી કાપ મૂકી રશિયાને ફટકો પહોંચાડવાના

યુરોપના નિર્ણય પછી વિદેશ મંત્રી જયશંકર પૂર્વીય યુરોપના પ્રવાસે રવાના થયા છે. યુકેન પર રશિયાના હુમલા વચ્ચે દુનિયામાં ખાતરના ભાવમાં નોંધપાત્ર ઊંચાણો આવ્યો છે. વિશ્વમાં રશિયા ખાતરનો મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ પ્રતિબંધોના કારણે હવે તે વિશ્વમાં ખાતરનું વેચાણ કરવા સક્ષમ નથી. જોકે, પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે ભારતે રશિયા પાસે અનેક વર્ષો સુધી ખાતરનો પૂરવટો મળી રહે તે માટે એક મોટા સોદાને અંતિમ ઓપ આપ્યો છે.

# 2020-21માં ભાજપને દાન પેટે રૂ. 477 કરોડ, કોંગ્રેસને 74 કરોડ રૂપિયા મળ્યા

નવી દિલ્હી

ભારતીય જનતા પાર્ટીને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૭૭.૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. જ્યારે કોંગ્રેસને ૭૪.૫૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. કોંગ્રેસને ભાજપને મળેલ દાનના ફક્ત ૧૫ ટકા રકમ જ મળી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા અહેવાલ અનુસાર ભાજપને વિવિધ કેપનીઓ, ઈલેક્ટોરલ ટ્રસ્ટ અને વ્યક્તિઓ પાસેથી કુલ ૪,૭૭,૫૪,૫૦,૦૭૭ રૂપિયા મળ્યા હતાં. ભાજપે ચાલુ વર્ષે ૧૪ માર્ચના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના દાનની રકમ અંગેનો અહેવાલ ચૂંટણી પંચને સુપ્રત કર્યો હતો. કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર તેને નાણાકીય વર્ષમાં ૨૦૨૦-૨૧માં કુલ ૭૪,૫૦,૪૮,૭૩૧ રૂપિયાનું દાન મળ્યું હતું. ચૂંટણી કાયદા



અનુસાર ૨૦,૦૦૦ રૂપિયાથી વધુનું દાન મળ્યું હોય તો રાજકીય પક્ષોને તે અંગેની જાણ ચૂંટણી પંચને કરવાની હોય છે. ઉલ્લેખનીય છે કે ભાજપ નેતૃત્વવાળું એનડીએ કોંગ્રેસ નેતૃત્વવાળા યુપીએને હરાવીને દેશમાં સત્તા પર છે.

# વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 કરોડ જેટલા ખેડૂતોને 21 હજાર કરોડ ટ્રાન્સફર કર્યા

અગાઉની સરકારો ભ્રષ્ટાચારને વ્યવસ્થાનો ભાગ માની ઘૂંટણીયે પડી હતી : પીએમ શિમલા

પીએમ મોદીએ શિમલામાં 'ગરીબ કલ્યાણ સંમેલન' કાર્યક્રમમાં ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના રૂ. ૨૧,૦૦૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ એનડીએ સરકારના શાસનના આઠ વર્ષ પૂરા થવાની ઊજવણીના પ્રસંગે શિમલામાં એક રોડ શોમાં ભાગ લીધો હતો, જ્યાં તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ સાથે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી દેશભરના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એવી સમસ્યા ઉકેલી રહી છે કે જે અગાઉ કાયમી સમસ્યા માનવામાં આવતી હતી. અમે



મતબેન્ક માટે નહીં પણ નવા ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યાં છીએ. મારી પાસે ૧૩૦ કરોડ ભારતીયોનો પરિવાર છે અને આ જીવન પણ તેમના સૌના માટે છે.

# જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વીડિયો લીકની તપાસ કરાવવા કોર્ટ તૈયાર

વારાણસી

વારાણસીના જ્ઞાનવાપી-શ્રંગાર ગૌરી પરિસરમાં સરવેક્ષણનો રિપોર્ટ અને વીડિયો સોમવારે લીક થઈ ગયા હતા. આ બાબતની તપાસ કરવા સંબંધિત અરજી કોર્ટે મંગળવારે સ્વીકારી હતી. જોકે, હિન્દુ પક્ષનું સીલબંધ કવર સ્વીકારવાનો કોર્ટે ઈનકાર કરી દીધો હતો. આ સંદર્ભમાં હવે ૪થી જુલાઈએ સુનાવણી થશે. વારાણસી કોર્ટે સોમવારે હિન્દુ પક્ષની ચાર મહિલા અરજદારોને બંધ કવરમાં જ્ઞાનવાપી-શ્રંગાર ગૌરી પરિસરમાં સરવેક્ષણનો રિપોર્ટ સોંપ્યો હતો, તેના થોડાક જ સમયમાં વીડિયો લીક થઈ ગયો હતો. ત્યાર પછી ચારેય મહિલાઓએ સીલબંધ રિપોર્ટ કોર્ટમાં સરન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે આ કવર પાછા સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જ્ઞાનવાપીના સરવેનો વીડિયો લીક થવા અંગે હિન્દુ પક્ષની ચારેય મહિલા અરજદારોએ સીબીઆઈ તપાસની માગણી કરતા કોર્ટમાં અરજી કરી હતી. વારાણસી કોર્ટે તપાસ કરવા સંબંધિત અરજી સ્વીકારી લીધી હતી. કોર્ટે કહ્યું કે ૪થી જુલાઈએ વીડિયો લીક તળાના કેસની પણ સુનાવણી થશે.

# અમરનાથ યાત્રા કરવા માટે હવે શ્રદ્ધાળુઓ ઓનલાઈન હેલિકોપ્ટર બુક કરાવી શકશે

શ્રીનગર

દિલ્હી હાઈકોર્ટમાં અમરનાથજી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બોર્ડે નક્કી કર્યું છે કે યાત્રાળુઓ માટે જે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે તેનું બુકિંગ ઓનલાઈન કરવામાં આવશે. હાઈકોર્ટમાં જે માગણી કરવામાં આવી હતી તેનો બોર્ડ દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દ્વારા માગણી કરવામાં આવી હતી કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટરનું બુકિંગ ઓનલાઈન કરવાની છૂટ આપવામાં આવે. જેની સુનાવણી વેળાએ બોર્ડે આ માગણીનો સ્વિકાર કર્યો હતો, પરીણામે હાઈકોર્ટે આ અરજીનો નિકાર કરી લીધો છે.

# 21-2022ના ચોથા ત્રિમાસિક ગાળા માટે અર્થતંત્ર 4.1 ટકાના દરે વૃદ્ધિ નાણાકીય વર્ષ 2021-22માં દેશનો GDP ગ્રોથ રેટ 8.7 ટકા નોંધાયો

નવી દિલ્હી

દેશમાં સતત ચોથા વર્ષે સારા ચોમાસાના સંકેતો વચ્ચે આ વિકાસદર એક શુભ સંકેત છે નાણાકીય વર્ષ 2021-22માં દેશની રાજકોષીય ખોટ જીડીપીના 6.9 ટકા રહેવાનું અનુમાન હતું પણ તેની સરખામણીએ 6.7 ટકા રહી છે. દેશના આર્થિક વિકાસને લઈને મંગળવારે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં GDP વૃદ્ધિ 8.7 ટકાના દરે નોંધાઈ

હતી કે જેની સરખામણીએ આગલા વર્ષે 6.6 ટકાનું સંકોચન નોંધાયું હતું તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ ડેટામાં જણાવ્યું હતું. નાણાકીય વર્ષ 2021-2022ના ચોથા ત્રિમાસિક ગાળા માટે દેશનું અર્થતંત્ર 4.1 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું. પાછલા વર્ષે સમાન ગાળા માટે દેશની જીડીપી 39.18 લાખ કરોડ રૂપિયાની હતી જે વિતેલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના અંતે 40.78 લાખ કરોડ રૂપિયાની નોંધાઈ હતી.

# કોંગ્રેસમાં ફરી ઘમસાણ: આશિષ દેશમુખ અને કલપ્પા બ્રિજેશનું રાજીનામું

શ્રીનગર

રાજ્યસભા બેઠક પર કોંગ્રેસમાં હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે પાર્ટી વતી 10 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે, ઉત્તર પ્રદેશના ઈમરાન પ્રતાપગઢીના નામને લઈને થઈ રહ્યો છે. હવે મહારાષ્ટ્રના એક નેતાએ ઈમરાન પ્રતાપગઢીના નામાંકનના વિરોધમાં કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસને જોરદાર આંચકો લાગ્યો છે. કોંગ્રેસના જાણીતા નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ બ્રિજેશ કલપ્પાએ પાર્ટીના પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામું ધરી દીધું છે. કલપ્પાએ સંરક્ષણ આપવા બદલ સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો.

# સરકારી કચેરીમાં ઓસામા બિન લાદેનનો ફોટો લગાડનાર અધિકારી સસ્પેન્ડ કરાયો

સરકારી અધિકારીએ ઓસામાને વિશ્વનો શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર ગણાવ્યો હતો

**લખનઉ**

ઉત્તર પ્રદેશના વીજળી વિભાગના સરકારી અધિકારીએ તેની ઓફીસમાં અલ કાયદાના સ્થાપક ઓસામા બિન લાદેનનો ફોટો લગાડનાર ગુરુવારે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઓસામાની ફોટો મુકનાર સરકારી અધિકારીએ તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર ગણાવ્યો હતો. આ ઘટના બાદ કચેરીના વરિષ્ઠ અધિકારીઓએ તેને સસ્પેન્ડ કરી દીધો છે.

થતાં આ સમગ્ર ઘટના લોકોના ધ્યાનમાં આવી હતી. દક્ષિણાયલ વિદ્યુત વિતરન નિગમ લિમિટેડમાં (DVVNL) કાર્યરત સબ-ડિવિઝનલ અધિકારી રવિન્દ્ર પ્રકાશ ગૌતમે તેની કચેરીમાં ઓસામા બિન લાદેનનો ફોટો મુક્યો હતો. આ ફોટોની નીચે તેણે સુયાના લખાવી હતી કે 'ઓસામા બિન લાદેન વિશ્વના સર્વશ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર'.

સોશયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોનું કચેરીના વરિષ્ઠ અધિકારીઓએ સંજ્ઞાન લીધું હતું અને ત્યારબાદ

સબ ડિવિઝનલ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ત્યારપછી તેને કચેરીમાંથી તાત્કાલીક દૂર કરવામાં આવ્યો હતો.

ફરુખાબાદના જીલ્લા મેજિસ્ટ્રેટ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસ બાદ DVVNLના મેનેજિંગ ડિરેક્ટરે SDO - રવિન્દ્ર પ્રકાશ ગૌતમને સસ્પેન્ડ કરી દીધો છે. ઉત્તરપ્રદેશ મૂલકી સેવા 1956ના નિયમો મુજબ SDO સામે આકરા પગલા લીધા છે. આ મામલાની તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

# કોંગ્રેસે મુસ્લિમ અને બ્રહ્મસમાજને આત્મસાત કરવા પ્રયત્નો શરૂ કર્યા

રાજ્યસભાના ઉમેદવારોના સમીકરણ દ્વારા યુપી મિશન -24 સાધવા કોશિષ : ચૂંટણી માટે યુપીના 3 નામો નિશ્ચિત લખનો

રાજ્યસભાના ઉમેદવારોના બહાને કોંગ્રેસે મિશન- ૨૦૨૪ સાધવા પ્રયત્નો હાથ ધર્યા છે યુ.પી. વિધાનસભા ચૂંટણીમાં માત્ર બે જ બેઠકો મેળવનાર કોંગ્રેસે યુપીના ત્રણ નેતાઓને રાજ્યસભા માટે ચૂંટ્યા છે. પાર્ટી બે મુખ્ય બ્રાહ્મણ ચહેરા અને એક મુસ્લિમ નેતાને રાજ્યસભામાં મોકલવાની કવાયત શરૂ કરી છે. આ સાથે મિશન- ૨૦૨૪ હાથ ધર્યું છે. મુસ્લિમ અને બ્રહ્મસમાજને પણ આત્મસાત કરવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. પ્રમોદ તિવારી પાર્ટીના

વરિષ્ઠ નેતા છે તેઓ નવ વખત એક જ પાર્ટીના સતત વિધાયક હોવાનો રેકોર્ડ ધરાવે છે. તેઓ ૯ વર્ષો સુધી મંત્રીપદે પણ રહેલા છે. ભાજપની આંધીમાં પણ તેઓની રણનીતિને લીધે તેઓની પુત્રી આરાધના મિશ્રા સતત વિધાયક બની રહ્યા છે. તેઓની રાજરમતને લીધે જુનિયરને સપાને ટેકો મળ્યો હતો અને તેઓ રાજ્યસભામાં ગયા હતા. હવે તેમને ફરીવાર ઉપલા ગૃહમાં મોકલવાની તૈયારીઓ થઈ રહી છે. તેઓને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે.

# યુપીના બરેલીમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ઝોકુ આવી જતાં અકસ્માત, 7 લોકોના મોત

દિલ્હીથી પરત ફરતી વખતે એમ્બ્યુલન્સ ડિવાઈડર પાર કરીને સામેથી આવી રહેલા કન્ટેનર સાથે અથડાઈ હતી



**લખનો**

ઉત્તર પ્રદેશના બરેલીમાં મંગળવારે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થઈ ગયા છે. એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ઉઘ આવી જવાના કારણે આ અકસ્માત થયું હતું. રામમૂર્તિ હોસ્પિટલની એમ્બ્યુલન્સ મંગળવારે સવારે ડિવાઈડર સાથે ટકરાઈ હતી. એમ્બ્યુલન્સ દિલ્હીથી બરેલી આવી રહી હતી. આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવારે 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઘટના ફતેહગંજ પશ્ચિમી વિસ્તારની છે.

અથડાઈ હતી. મૃતકોમાં 4 પુરુષો અને 3 મહિલાઓ સામેલ છે. બધા મૃતકો પીલીભીતના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને મૃતકોના મૃતદેહને કબ્રજામાં લીધા છે. એસએસપી રોહિત સિંહ સજવાણે જણાવ્યું કે, દિલ્હી-લખનો રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક એમ્બ્યુલન્સ દિલ્હીથી આવી રહી હતી જેમાં 6 લોકો બેઠા હતા જે પીલીભીતના રહેવાસી છે. આ લોકો દિલ્હીથી એકઅપ કરાવીને પરત ફરી રહ્યા હતા. 30 તારીખે તેમની અપોઈન્ટમેન્ટ હતી. આ એમ્બ્યુલન્સ દિલ્હીથી પરત ફરતી વખતે ડિવાઈડર પાર કરીને સામેથી આવી રહેલા કન્ટેનર સાથે અથડાઈ હતી.

# ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે વર્ષ પછી પેસેન્જર ટ્રેન સર્વિસ શરૂ કરાઈ

**નવી દિલ્હી**

કોવિડ-૧૯ને લીધે છેલ્લા બે વર્ષોથી બંધ રહેલી ભારત- બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેન સર્વિસ રવિવારથી ફરી શરૂ કરવામાં આવી છે. તેમ જણાવતા ત્યાંના રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ચાલતી મૈત્રી એક્સપ્રેસ સમાહમાં પાંચ દિવસ ઠાકા કેન્ટોન્મેન્ટથી કોલકાતા વચ્ચે દોડશે જ્યારે બંધન એક્સપ્રેસ દેશના દક્ષિણ પશ્ચિમ ભાગે રહેલા ખુલનાથી કોલકાતા વચ્ચે દોડશે. બાંગ્લાદેશના રેલવે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ૪૬૫ યાત્રીઓને લઈ જવાની ક્ષમતા ધરાવતી આ ટ્રેનોમાં સરેરાશ ૩૦૦ પેસેન્જર્સ તો ઓછામાં ઓછા રહેવા સંભવ છે.

# હનુમાનજીના જન્મ સ્થળ મામલે નાસિકમાં ઘમાસાણ ધર્મ સંસદ વખતે સ્વામી ગોવિંદાનંદ પર માર્ઘકથી હુમલા કરાતાં હોબાળો

**નાસિક**

ભગવાન હનુમાનના જન્મસ્થળને લઈને બોલાવાયેલી ધર્મ સંસદમાં શાસ્ત્રાર્થ દરમિયાન મંગળવારે વિવાદ ઊભો થઈ ગયો. મહારાષ્ટ્રના નાસિકમાં આ મુદ્દા પર શાસ્ત્રાર્થ દરમિયાન મારામારીની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. એક સંતને કણોટકના ગોવિંદાનંદ પર મીડિયાના માર્ઘકથી મારવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ આવી જતાં ઉપસ્થિત પોલીસે



ગોવિંદાનંદ સરસ્વતીને એક રૂમમાં લઈ જઈને બેસાડી દીધા અને હોલ પણ ખાલી કરાવ્યો. હાલ આ ધર્મ સંસદને સ્થગિત કરી દેવાઈ છે.

# ટેક્સ ચોરી બદલ દેશભરમાં દારુના વેપારીઓના 400 સ્થળોએ આઈટીના દરોડા

**નવી દિલ્હી**

આઈટી વિભાગે દેશભરમાં દારુના વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. આઈટી વિભાગના અધિકારીઓએ દેશભરના આશરે ૪૦૦ જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં મુંબઈ, દિલ્હી, ગુરુગ્રામ જેવા શહેરો સહિત પાંચ રાજ્યોનો સમાવેશ થાય છે. ટેક્સ ચોરી મામલે આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક પુરાવા પણ વિભાગ દ્વારા એકઠા કરવામાં આવ્યા હતા. મુંબઈમાં પણ સ્થાનિક આઈટી વિભાગની ટીમ બાંદ્રા કુલ્લા કોમ્પ્લેક્સ સ્થિત એમ્બેસી ગુરુપની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કોઈને જ બહાર જવા કે બહારથી આવતા અટકાવી દેવાયા હતા.

# મહારાષ્ટ્રના રાયગઢમાં ઘરેલું વિવાદથી માતાએ 6 બાળકોને ફૂવામાં ફેંકી દીધા

ફાફમાઉ ઘાટની તસવીરો ખુબજ ડરામણી, મૃતદેહોને દફનાવવાની રમત આડેઘડ ચાલી રહી છે

**રાયગઢ**

મહારાષ્ટ્રના રાયગઢથી એક હયમયાવી મૂકતી ઘટના સામે આવી છે જ્યાં માતાએ તેના 6 સગીર બાળકોને ફૂવામાં ફેંકીને મારી નાખ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘરેલું વિવાદને કારણે મહિલાએ આ ભયાનક પગલું ભર્યું હતું. મામલો મુંબઈથી 100 કિલોમીટર દૂર મહાડ તાલુકાના ખારાવલી ગામનો છે.



તેની સાથે મારપીટ તેણે બાળકોને ફૂવામાં ફેંકી દીધા હતા. અને બાળકોના મોત થયા હતા. મૃતક બાળકોની ઉંમર 18 મહિનાથી 10 વર્ષની વચ્ચે હતી.

બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારબાદ માતાએ પોતાના દિયરને ઘટના વિશે જણાવ્યું હતું. શરૂઆતમાં લોકોએ તેની વાતને નજરઅંદાજ કરી, પરંતુ સાંજે બાળક ન દેખાતા લોકોએ ફૂવામાં શોધ કરી, જ્યાં પુત્રની લાશ પડી હતી. લાતૂર જિલ્લાના નિલંગા પોલીસ સ્ટેશનથી મળેલી જાણકારી પ્રમાણે મહિલાનો પતિ સાથે ઝઘડો થયો હતો.

# હરિયાણામાં સેપ્ટિક ટેન્કમાં પડી જતાં બાળક સહિત ત્રણનાં મોત

બાળક ટાંકીના ઢાંકણ પર ઊભો હતો ત્યારે તે તૂટી જતાં અંદર પટકાયો, પિતા-કાકાના બચાવવા જતા મોત થયા

**ચંદિગઢ**

હરિયાણાના નુહ જિલ્લામાં બિહોર ગામના રહેવાસી દિનુના ઘરની બહાર ૨૦ ફૂટ ઊંડી સેપ્ટિક ટાંકી બનાવવામાં આવી હતી. ટાંકી પથ્થરના સ્લેબથી ઢંકાયેલી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દિનુનો ૮ વર્ષનો પૌત્ર આરિઝ મંગળવારે ટાંકી પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન તે ટાંકી પર ઉભો રહ્યો હતો. જેના કારણે તેનું કવર તૂટી ગયું હતું.

આ ઘટના બાદ છોકરાના પિતા સિરાજુ (૩૦) અને તેના કાકા સલામુ (૩૫) તેને બચાવવાના પ્રયાસમાં ટાંકી અંદર ગયા હતા પરંતુ લાંબા સમય સુધી કોઈ બહાર ન આવતાં પરિવારના લોકોએ બુમાબુમ કરી હતી. ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોની મદદથી મૃતદેહોને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ત્રણેયના મોત થયા છે.

# સોનિયા કોરોના પોઝિટિવ, પોતાને આઈસોલેટ કર્યા

**નવી દિલ્હી**

કોંગ્રેસના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુરુવારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, તેઓને સામાન્ય તાવ હતો, આ ઉપરાંત સામાન્ય લક્ષણો પણ જોવા મળ્યા હતા, જે બાદ તેઓએ પોતાને આઈસોલેટ કરી દીધા છે. તેઓને જરૂરી મેડિકલ સારવાર આપવામાં આવી રહી છે. સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ આવ્યા છે કે, એક દિવસ પહેલાં જ નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઈડી સોનિયા ગાંધી, ગાંધી વિરુદ્ધ સમન્સ પાઠવ્યું છે. તમને જણાવી દઈએ કે, ૮ જૂનના





# ભારતીય ટીમ હવે બાયો-બબલ વિના રમશે

। નવી દિલ્હી ।

કોરોના વાઈરસની મહામારી લગભગ ખતમ થઈ ચૂકી છે અને ક્રિકેટર્સ માટેના સખત બાયો-બબલનો પણ હવે અંત લાવી દેવામાં આવ્યો છે જેના કારણે ખેલાડીઓને માનસિક રીતે ઘણી રાહત થઈ છે. સાઉથ આફ્રિકા સામે નવી દિલ્હી ખાતે નવમી જૂનથી શરૂ થઈ રહેલી ટી૨૦ શ્રેણી બાયો-બબલ વિના રમાશે. બે મહિના સુધી રમાયેલી આઈપીએલ બાદ બીસીસીઆઈએ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બોર્ડે આ શ્રેણી માટે ટીમમાં સામેલ તમામ ખેલાડીને પાંચમી જૂન સુધી દિલ્હીમાં ભેગા થવાનો નિર્દેશ કર્યો છે. આ પહેલાં પ્રવાસી સાઉથ આફ્રિકન ટીમ બીજી જૂને દિલ્હી પહોંચી જશે અને શ્રેણી માટેની પૂર્વતૈયારીઓ શરૂ કરશે. ક્રિકેટ ડી કોક અને ડેવિડ મિલર આઈપીએલનો હિસ્સો હોવાના કારણે તેઓ દિલ્હીમાં જ રહેશે અને ટીમ સાથે જોડાઈ જશે. સાઉથ આફ્રિકા સામેની શ્રેણી બાદ ભારતીય ટીમ બે ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ માટે આચરલેન્ડનો પ્રવાસ ખેડશે.

## ટી-20 શ્રેણી માટે સા. આફ્રિકન ટીમનું દિલ્હીમાં આગમન, વર્લ્ડ રેકોર્ડ ભારતનો ટાર્ગેટ રહેશે

। નવી દિલ્હી ।

ટેમ્બા બાવુમાના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાની ટી૨૦ ટીમે ગુરુવારે ભારતમાં આગમન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા ખાતે ચાલુ વર્ષના અંતે રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં બંને ટીમો માટે આ શ્રેણી ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સાઉથ આફ્રિકા ૨૦૧૫ના ઓક્ટોબર તથા ૨૦૧૯ના સપ્ટેમ્બર બાદ ભારતમાં પ્રથમ વખત દ્વિપક્ષીય શ્રેણી રમશે. નવી દિલ્હી પહોંચ્યા બાદ સાઉથ આફ્રિકન બોર્ડે ટીમની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી૨૦ શ્રેણી માટે ભારતે પોતાના સિનિયર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી તથા જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને આરામ આપ્યો છે. લોકેશ રાહુલને સુકાની તથા રિષભ પંતને ઉપસુકાની બનાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકન ખેલાડી ક્રિકેટ ડી કોક, ડેવિડ મિલર આઈપીએલમાં રમ્યા બાદ ભારતમાં જ રહ્યા હતા અને તેઓ સીધા ટીમ સાથે જોડાઈ ગયા હતા. ડેવિડ મિલરે ગુજરાત ટાઈટન્સને આઈપીએલ ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. નવમી જૂનથી ટી૨૦ શ્રેણીનો પ્રારંભ થશે.



આફ્રિકન બોર્ડે ટીમની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી૨૦ શ્રેણી માટે ભારતે પોતાના સિનિયર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી તથા જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને આરામ આપ્યો છે. લોકેશ રાહુલને સુકાની તથા રિષભ પંતને ઉપસુકાની બનાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકન ખેલાડી ક્રિકેટ ડી કોક, ડેવિડ મિલર આઈપીએલમાં રમ્યા બાદ ભારતમાં જ રહ્યા હતા અને તેઓ સીધા ટીમ સાથે જોડાઈ ગયા હતા. ડેવિડ મિલરે ગુજરાત ટાઈટન્સને આઈપીએલ ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. નવમી જૂનથી ટી૨૦ શ્રેણીનો પ્રારંભ થશે.

## વર્લ્ડ ચેમ્પિયન નિખતે બાવડા પર વડાપ્રધાન મોદીના હસ્તાક્ષર લીધા



નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કરનારી મહિલા બોક્સર્સની મુલાકાત લીધી હતી. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બોક્સર નિખત ઝરીન, મનીષા મૌન અને પરવીન હુડાએ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. નિખતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે જ્યારે મનીષા મૌન અને પરવીન હુડાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. નિખતે વડાપ્રધાન સાથે સેલ્ફી લીધી હતી અને પોતાના બાવડા પર વડાપ્રધાન મોદીના હસ્તાક્ષર પણ લીધા હતાં. વડાપ્રધાને ત્રણે મહિલા બોક્સર સાથે તેમના સુંદર દેખાવ અંગે ચર્ચા કરી હતી અને તે બદલ અભિનંદન આપ્યા હતાં. નિખતે વડાપ્રધાન સાથેના ફોટોગ્રાફ્સને ટ્વિટર પર શેર કરવાની સાથે લખ્યું હતું કે વડાપ્રધાન સરને મળવાનું બહુમાન પ્રાપ્ત થયું. થેંક્યુ સર. નોંધનીય છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે.સી. રાવે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનારી નિખત ઝરીન અને આઈએસએસએફ જુનિયર વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનારી ઈશાસિંહને બે-બે કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સાથોસાથ તેમને બંજારા હિલ્સ અથવા જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં જમીનની ફાળવણી કરવાની પણ જાહેરાત કરી છે.

## વિમેન્સ ટીમે ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો

નવી દિલ્હી

અઝરબેજાન ખાતે ચાલી રહેલા આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં વિમેન્સની ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો હતો. ઈલાવેનિલ વાલારિવાન, રમિતા અને શ્રેયા અગ્રવાલની વિમેન્સ ટીમે ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું હતું. ભારતીય ટીમે ડેનમાર્કની એન્ના નિલસન, એમ્મા કોચ અને રિક્કે માર્એંગ ઈસબેનની ટીમને ૧૭-૫ના સ્કોરથી હરાવી હતી. પોલેન્ડને આ ઈવેન્ટમાં



શ્રેયા અગ્રવાલની વિમેન્સ ટીમે ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું હતું. ભારતીય ટીમે ડેનમાર્કની એન્ના નિલસન, એમ્મા કોચ અને રિક્કે માર્એંગ ઈસબેનની ટીમને ૧૭-૫ના સ્કોરથી હરાવી હતી. પોલેન્ડને આ ઈવેન્ટમાં

કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બીજા રાઉન્ડમાં ભારતીય ટીમ પોલેન્ડ બાદ બીજા ક્રમે રહી હતી. મેન્સ એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ભારતના રુદ્રાક્ષ પાટિલ, પાર્થ માખિજા અને ધનુષ શ્રીકાંત બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં કોએશિયા સામે ૧૦-૧૯ના સ્કોરથી હારી ગયા હતા. ભારતીય રાઈફલ ટીમ મેડલ્સની યાદીમાં પાંચમા સ્થાને છે. સર્બિયા ટોચના ક્રમે છે. ભારતે આ વર્લ્ડ કપમાં માત્ર ૧૨ સબ્યોની ટીમને શૂટિંગ રેન્જમાં ઉતારી હતી.

## સતત ૩૪મો વિજય હાંસલ કરી ઘગા સ્વિચાતેક ફાઇનલમાં પ્રવેશી

પેરિસ : વિશ્વની પ્રથમ ક્રમાંકિત પોલેન્ડની ઘગા સ્વિચાતેક ૨૦૨૨ની સિઝનમાં પોતાના દબદબાભર્યા પ્રદર્શનને જારી રાખીને વર્ષના બીજા ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધી હતી. સતત ૩૪મો વિજય હાંસલ કરનાર સ્વિચાતેકે વિમેન્સ સિંગલ્સની પ્રથમ સેમિફાઇનલમાં ડારિયા કસાલ્કિનાને કોષ્ઠ પણ મુશ્કેલી વિના ૬-૨, ૬-૧થી હરાવી હતી. સ્વિચાતેકે ૩૪મો વિજય હાંસલ કરીને અમેરિકાની ટિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સના રેકોર્ડને પણ સરભર કર્યો છે. સેરેનાએ ૨૦૧૩માં સતત ૩૪ વિજય હાંસલ કર્યા હતા. સેરેનાની મોટી બહેન વિનસ વિલિયમ્સને ૨૦૦૦ની સિઝનમાં સતત ૩૫ મેચ જીતી હતી જે વિમેન્સ સિંગલ્સનો હજુ પણ અકબંધ રેકોર્ડ છે. ફાઇનલમાં વિજય મેળવવાની સાથે સ્વિચાતેક વિનસના રેકોર્ડની બરોબરી કરી શકે છે. ઓસ્ટ્રેલિયાની એલને બાર્ટીએ અકાળે લીધેલી નિવૃત્તિ બાદ પ્રથમ ક્રમાંકિત બનેલી સ્વિચાતેકે ૨૦૨૦માં પોતાના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપનના સ્વરૂપે જ જીત્યો હતો.



## નોર્વે ચેસ ચેમ્પિયનશિપ: વિશ્વનાથન આનંદે મેક્સિમ વેચિરને હરાવ્યો

નવી દિલ્હી

વિશ્વનાથન આનંદે નોર્વેજિયન ચેસ ટૂર્નામેન્ટના ક્લાસિકલ સેક્શનના પ્રથમ રાઉન્ડમાં ૪૦ મૂવમાં જ મેક્સિમ વેચિર-લાગ્રાવને પરાસ્ત કર્યો હતો. ફ્રેન્ચ ખેલાડી ઉપરના વિજય સાથે ભારતીય ગ્રાન્ડ માસ્ટરને ત્રણ પોઈન્ટનો લાભ થયો છે. બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં અમેરિકન વિસલેએ તેમૂર રાજદાબોવને પરાજિત કરી આનંદની સમક્ષ આવી ગયો હતો જ્યારે મેગ્નસ કાર્લસને ચીનના વાંગ હેડ સાથે ડ્રો કરી હતી. ક્લાસિકલ અગાઉ રમાયેલી બ્લિટ્ઝ ઈવેન્ટમાં આનંદે સાતમા રાઉન્ડમાં વર્લ્ડ ચેમ્પિયન કાર્લસને આંચકો આપ્યો હતો. જો કે ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયનને ચોથા રાઉન્ડમાં નેધરલેન્ડના અનીશ ગિરિ સામે અને નવમા રાઉન્ડમાં વેચિર લાગ્રાવ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને ૧૦ ખેલાડીઓની આ ટૂર્નામેન્ટને પાંચ પોઈન્ટ સાથે સમાપ્ત કરી હતી.

## બોપન્ના સાત વર્ષ બાદ કોઈ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં

બે કલાક ચાર મિનિટનો સંઘર્ષ કર્યા બાદ લોઈડ-હેનરીની જોડીને હરાવી

પેરિસ

ભારતનો અનુભવી ખેલાડી રોહન બોપન્ના અને તેના નેધરલેન્ડ્સના સાથીદાર મિડલકૂપે છેલ્લા સાત વર્ષમાં પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઈન્ડો-ડચ જોડીએ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લોઈડ ગ્લાસપૂલ તથા હેનરી હેલિયોવારને બે કલાક ચાર મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ ૪-૬, ૬-૪, ૭-૬થી પરાજય આપ્યો હતો. આ પહેલાં બોપન્ના ૨૦૧૫ના વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમમાં રોમાનિયાના ફ્લોરિન મર્જિયા સાથે સેમિફાઇનલમાં પહોંચ્યો હતો જેમાં તેમનો જિન જુલિયન રોજર અને હોરિયા ટેકાઉ સામે પરાજય થયો હતો. ૪૨ વર્ષીય બોપન્ના અને ૩૮ વર્ષીય મિડલકૂપ હવે ૧૨મો ક્રમાંક ધરાવતા માર્શ્લો અરેવાલો તથા જિન જુલિયન રોજર સામે રમશે. બોપન્ના ૨૦૦૮માં પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનમાં રમ્યો હતો અને ત્યારથી તે પ્રત્યેક વર્ષે મેન્સ ડબલ્સની ઈવેન્ટમાં ઊતર્યો હતો પરંતુ ક્યારેય અંતિમ-૪માં રમ્યો નહોતો.



થયો હતો. ૪૨ વર્ષીય બોપન્ના અને ૩૮ વર્ષીય મિડલકૂપ હવે ૧૨મો ક્રમાંક ધરાવતા માર્શ્લો અરેવાલો તથા જિન જુલિયન રોજર સામે રમશે. બોપન્ના ૨૦૦૮માં પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનમાં રમ્યો હતો અને ત્યારથી તે પ્રત્યેક વર્ષે મેન્સ ડબલ્સની ઈવેન્ટમાં ઊતર્યો હતો પરંતુ ક્યારેય અંતિમ-૪માં રમ્યો નહોતો.

## એશિયા કપ હોકી : જાપાનને હરાવી ભારતે બ્રોન્ઝ મેડલ જીતી લીધો

નવી દિલ્હી : ભારતીય હોકી ટીમે બુધવારે જાપાનને ૧-૦થી પરાજિત કરીને એશિયા કપ હોકીનો બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. આ અગાઉ મંગળવારે સાઉથ કોરિયા સામેની મેચ ડ્રો કર્યા બાદ ભારત ખિતાબી રેસમાંથી બહાર થઈ ગયું હતું. આ હાર બાદ ત્રીજા અને ચોથા સ્થાન માટેની મેચમાં જાપાન સામે ભારતીય યુવા ખેલાડીઓએ તમામ તાકાત કામે લગાડીને જાપાન સામેની મેચ જીતી લીધી હતી. ભારત તરફથી એકમાત્ર ગોલ રાજકુમાર પાલે કર્યો હતો. સુપર-૪ રાઉન્ડમાં હાજર ભારત, મલેશિયા અને કોરિયા ત્રણેયનું અભિયાન પાંચ-પાંચ પોઈન્ટ પર સમાપ્ત થયું હતું. જો કે ભારતીય ટીમ ગોલ વચ્ચેના અંતરના આધાર પર ત્રીજા સ્થાને રહી હતી.



# અમેરિકામાં બિઝી મેમોરિયલ ડે વીકેન્ડ 3 દિવસમાં 5,000થી વધુ ફ્લાઈટ્સ રદ

હવામાન, કર્મચારીઓની અછત, કોવિડ વધતાં કેસને લીધે એરલાઇન્સે ફ્લાઈટ્સ રદ કરી  
એટલાન્ટા

અમેરિકામાં મેમોરિયલ વીકેન્ડની વ્યસ્તતાના લીધે સમગ્ર વિશ્વમાં ફ્લાઈટ કેન્સલેશનમાં નોંધપાત્ર વધારો થયો છે. રવિવારે બપોરના અઢી વાગ્યા સુધીમાં ૧,૨૬૦ ફ્લાઈટથી વધુ રદ થઈ ચૂકી છે, એમ ફ્લાઈટ ટેકિંગ વેબસાઈટ ફ્લાઈટવેરે જણાવ્યું હતું. તેના પછી શુક્રવારે ૨,૩૦૦થી વધારે કેન્સલેશન જોવા મળ્યા છે અને બીજા ૧,૫૦૦ શનિવારે જોવા મળ્યા છે. ત્રણ દિવસમાં પાંચ હજારથી વધારે ફ્લાઈટ રદ થઈ હતી. એકલા રવિવારે જ ૩૫૦થી વધારે કેન્સલેશન જોવા મળ્યા હતા. આ ફ્લાઈટ્સ ક્યાં તો અમેરિકા આવતી હતી કે અમેરિકાના શહેરોની હતી. ડેલા એરલાઇન્સે સૌથી વધુ ૨૫૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે જે તેની કુલ કામગીરીના ૮ ટકા થાય છે. રવિવારે બપોર સુધીમાં ડેલાની ૧૫૦થી



વધુ ફ્લાઈટ્સ રદ થઈ હતી, એમ ફ્લાઈટવેરે જણાવ્યું હતું. ફ્લાઈટ્સ રદ થવાનું કારણ બરાબ હવામાન અને એર ટ્રાફિક કંટ્રોલ એકશન હતું. એટલાન્ટા સ્થિત ડેલાએ જણાવ્યું હતું કે તે મેમોરિયલ ડે વીકેન્ડ આગળ વધતો હતો તેમ કમસેકમ ૨૪ કલાક એડવાન્સમાં ફ્લાઈટ રદ કરવા પ્રયત્નશીલ હતી.

# પેસિફિક ટાપુઓ સાથે સંરક્ષણ, કરારો પડી ભાંગતા ચીનને ફટકો

બેજિંગ

ચીન અને પેસિફિક દ્વિપ-સમુદ્ર વચ્ચે સલામતી, સંરક્ષણ અને આર્થિક બાબતો વિષેના કરારો પડી ભાંગ્યા છે. આથી દક્ષિણ પેસિફિક ટાપુઓમાં પ્રસાર કરવાની ચીનની મહેચ્છાઓને ફટકો પડ્યો છે.

ફીજીના પાટનગર સુવામાં ચીનના વિદેશમંત્રી વાંગ ચી અને પેસિફિકમાં રહેલા ટાપુ- રાષ્ટ્રોના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાયેલ આ પ્રકારની સૌથી પહેલી જ બેઠકમાં, કેટલાક ટાપુ- રાષ્ટ્રોના વિદેશ મંત્રીઓએ ચીને રજૂ કરેલી વ્યાપાર અને સંરક્ષણ તથા સલામતી વિષેની દરખાસ્તોના કેટલાક મુદ્દાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા

ત્યારે વાંગ ચીએ તેઓને વધુ પડતા ચિંતાતુર ન રહેવા અનુરોધ કર્યો હતો પરંતુ તે વિદેશમંત્રીઓને સંતોષ થયો ન હતો તેમ ઓસ્ટ્રેલિયાના ABC ન્યુઝે જણાવ્યું છે. તે સર્વવિદિત છે કે દક્ષિણ પેસિફિકમાં દૂર દૂરના વિસ્તારો સુધી પોતાની રાજકીય છાપ ઊંડી કરવા ચીન પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ તે વિસ્તારમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો જ પહેલેથી પ્રભાવ રહેલો છે. તેથી તેઓ ચીનનો પ્રભાવ વધતો રોકવા સતત પ્રયત્નો કરે તે સહજ છે.

બીજી તરફ ચીને તેવી સફાઈ કરી છે કે ચીન દ્વારા તે પ્રદેશમાં સ્થાપવામાં આવતો સહકાર કોઈ ત્રીજા દેશને લક્ષ્યમાં રાખી કરાયો નથી.

# પાકિસ્તાનમાં ટ્રેનમાં ટિકિટ ચેકર સહિત ૩નો યુવતી પર બળાત્કાર

પોલીસે ત્રણેય બળાત્કારીઓની ધરપકડ કરી લીધી

ઈસ્લામાબાદ

પાકિસ્તાન રેલ્વે તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં, 28 મેના રોજ મુલતાનથી કરાચી જઈ રહેલી બહુઉદીન ઝકારિયા એક્સપ્રેસમાં એક યુવતી મુસાફરી કરી રહી હતી. ત્યારબાદ ટિકિટ ચેકર સહિત ૩ લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. પાકિસ્તાનમાં ચાલતી ટ્રેનમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટિકિટ ચેકરે છોકરીને

એસી કોચમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ કર્યો. આ પછી સ્ટાફના અન્ય બે સભ્યોએ તેની સાથે દુષ્કર્મ કર્યો હતો. જોકે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે મહિલા પર સામૂહિક દુષ્કર્મની પુષ્ટિ કરી છે. પાકિસ્તાન રેલ્વેના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 28 મેના રોજ મુલતાનથી કરાચી જઈ રહેલી બહુઉદીન ઝકારિયા એક્સપ્રેસમાં એક યુવતી મુસાફરી કરી રહી હતી. ત્યારબાદ ટિકિટ ચેકર સહિત ૩ લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો.

# યુરોપનો રશિયા ઉપર વધુ એક પ્રતિબંધ કૂડની ખરીદી પર 90 ટકાનો કાપ મૂક્યો

રશિયાનો વળતો જવાબ : પુતિને નેધરલેન્ડનો કુદરતી ગેસ સપ્લાય કાપ્યો, ડેન્માર્કનો કાપશે

બ્રસેલ્સ

યુકેન પર આક્રમણ બદલ અમેરિકા-યુરોપે રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યા છે, પરંતુ હજુ આ પ્રતિબંધોની રશિયા પર ખાસ અસર થઈ નથી. હવે યુરોપના દેશોએ રશિયા પર વધુ આકરો પ્રતિબંધ મૂકવા તૈયારી કરી છે. તેની કૂડ ઓઈલ અને કુદરતી ગેસની જરૂરિયાત માટે રશિયા પર નિર્ભર યુરોપે રશિયાન કૂડની ખરીદી પર ૯૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય કરીને વ્લાદિમિર પુતિનને મોટો ફટકો પહોંચાડ્યો છે. આ



પ્રતિબંધોના પગલે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક બ્રેન્ટ કૂડ ઓઈલનો ભાવ ૧૨૨ ડોલરને પાર થઈ ગયો છે. અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે મંગળવારે જણાવ્યું હતું કે, યુરોપીયન સંઘના નેતાઓએ બ્રસેલ્સમાં શિખર

સંમેલનના પહેલા દિવસે રશિયાન કૂડની બે તૃતિયાંશથી વધુની આયાત પર પ્રતિબંધ મૂકવા સહમતિ વ્યક્ત કરી છે. મિશેલે ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્રતિબંધ પેકેજમાં અન્ય કઠોર ઉપાયોનો સમાવેશ થાય છે. તેમાં સૌથી મોટી રશિયાન બેન્ક સબેર બેન્કને ડી-સ્વિફ્ટ કરવી અને રશિયાન સરકારની માલિકીવાળા પ્રસારકો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. રશિયા પર દબાણ કરવા તેના સૌથી આકર્ષક ઊર્જા સેક્ટર પર દબાણ લાવવા પશ્ચિમી દેશો પ્રયાસ કરી રહ્યા હતા.

# રશિયાની ટેંકો અને તોપોના ભુક્કા બોલાવીને યુકેને યોજયું કાટમાળનું પ્રદર્શન, લોકો જોવા ઉમટી પડ્યા



યુકેનના પાટનગર કીવમાં રશિયાન સેનાની નાશ કરવામાં આવેલી ટેંકો, તોપો સહિતના શસ્ત્રોના કાટમાળનું પ્રદર્શન યોજાયો હતો. યુકેનના વિદેશ મંત્રાલયે રશિયાના ફેલ કરવામાં આવેલા શસ્ત્રો અને તેના કાળમાળની તસ્વીરો પોસ્ટ કરી હતી. યુવાઓ તોપ અને ટેંકોની નજીક સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.

# બ્રિટનના નવા એચપીઆઈ વિઝા રૂટથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે

લંડન

બ્રિટન સિવાયની વિશ્વની ટોચની ૫૦ યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયેલા ભારતીયો સહિતના વિદ્યાર્થીઓ નવા હાઈ પોટેન્શિયલ ઈન્ડીવિડ્યુઅલ (એચપીઆઈ) વિઝા રૂટથી બ્રિટન આવીને નોકરી કરી શકશે. આજે આ નવા એચપીઆઈ વિઝા રૂટની જાહેરાત કરવામાં આવી હતી. એક સંયુક્ત નિવેદનમાં ભારતીય મૂળના કેબિનેટ પ્રધાન રિશી સુનક અને પ્રિતી પટેલે જણાવ્યું હતું કે વિશ્વના શ્રેષ્ઠ અને તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે આ નવા વિઝા રૂટની શરૂઆત કરવામાં આવી છે. આ રૂટ હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને બે વર્ષના વર્ક વિઝા આપવામાં આવશે.

# યુકેન-રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ફુગાવામાં વધારો યુરોઝોનમાં મેમાં ફુગાવો વધી 8.1 ટકાના વિક્રમજનક સ્તરે

મોસ્કો

યુકેનમાં રશિયાના યુદ્ધને કારણે ઉર્જા અને ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે યુરોઝોનમાં ફુગાવો વધીને ૮.૧ ટકાના વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે. યુરોપિયન યુનિયન સ્ટેટિસ્ટિક્સ એજન્સી યુરોસ્ટેટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ યુરોનો ઉપયોગ કરતા ૧૯ દેશોમાં માર્ચ અને એપ્રિલમાં ફુગાવો ૭.૪ ટકા હતો. મે મહિનામાં નોંધાયેલો ૮.૧ ટકાનો ફુગાવો ૧૯૯૭માં ફુગાવાના

આંકડા રાખવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીનો સૌથી ઉંચો ફુગાવો છે. વધી રહેલા ફુગાવાને કારણે લોકોનું ઘરેલું બજેટ ખોરવાઈ રહ્યું છે. જેના કારણે ફુગાવાનું સ્તર હવે વધુ ઉંચા સ્તરે ન જાય તે માટે સત્તાવાળાઓ પર દબાણ વધી રહ્યું છે. મે મહિનામાં ઉર્જાના ભાવમાં ૩૯.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. યુદ્ધ અને વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવ વધવાના કારણે યુરોઝોનના ૩૪.૩ કરોડ લોકો માટે ગુજરાન ચલાવવું વધુ મોંઘુ થતું જાય છે.

# હિસાને કારણે શ્રીલંકાની વીમા કંપનીને રૂ. 100 કરોડની ખોટ

કોલંબો

શ્રીલંકાની સરકારી માલિકીની વીમા કંપનીએ આ મહિને સરકાર વિરોધી અને સરકાર તરફી દેખાવકારો વચ્ચે થયેલી હિંસક અથડામણને કારણે એક અબજ શ્રીલંકન રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે એવી માહિતી ન્યુ યોર્ક સ્થિત રેટિંગ એજન્સી ફ્રિચે આપી છે. ૯મી મેના રોજ શ્રીલંકામાં ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષના સમર્થકોએ સરકાર વિરોધી શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા લોકો પર હુમલો કરતા હિંસા ફાટી નીકળી હતી. જેમાં ૧૦ જણાના મોત થયા હતા તેમજ

૨૦૦થી વધુને ઈજા થઈ હતી અને ૭૮ સાંસદોની મિલકતો પર હુમલા થયા હતા. સરકાર વિરોધી દેખાવકારો ખોરાક, ઈંધણ અને ઊર્જાની તીવ્ર તંગી સર્જનાર દેશની સૌથી આકરી આર્થિક કટોકટી બદલ વડા પ્રધાનની હકાલપટ્ટી ઈચ્છી રહ્યા હતા. હડતાળ, હુલ્લડ, નાગરિક અશાંતિ અને આંતકવાદ સામે વિમા કવચ આપતી રાજ્યની માલિકીની નેશનલ ઈન્શ્યોરન્સ ટ્રસ્ટ ફન્ડ બોર્ડએ આ હિંસાનું નુકસાન વેઠવું પડશે જ્યારે પ્રાથમિક વીમા પૂરો પાડનાર કંપનીને ઓછી અસર થશે એવી જાણકારી ફ્રિચે આપી છે.

# ભારતીય મૂળના US સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ 'વિશિષ્ટ નેતૃત્વ' પુરસ્કારથી સન્માનિત

વોશિંગ્ટન



આ સન્માન એનાયત કર્યું. ઈલિનોઈસના મંત્રી જેસી વ્હાઈટે 48 વર્ષીય ડેમોક્રેટિક નેતા કૃષ્ણમૂર્તિને પુરસ્કાર પ્રદાન કર્યું. રાજા કૃષ્ણમૂર્તિ 2017થી ઈલિનોઈસના આઠમાં સંસદીય જિલ્લા માટે અમેરિકી પ્રતિનિધિ તરીકે સેવાઓ આપી રહ્યા છે.

# બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી પરિસ્થિતિ વણસી: 91ના મોત, 24 ગુમ

ફ્લોરિડા અને સ્વીડને નાટો સંગઠનમાં સામેલ થવા માટે અરજીઓ જમા કરાવી દીધી રિયો ડી જાનેરો

બ્રાઝિલમાં પૂરમાં મૃતકોની સંખ્યા 91 સુધી પહોંચી ગઈ છે અને 24 થી વધારે લોકો લાપતા છે. ઉત્તરી બ્રાઝિલના પરનામબુકો રાજ્યના અધિકારીઓએ આ જાણકારી આપી છે. એક સરકારી નિવેદન અનુસાર રાજ્ય અને કેન્દ્ર સરકારના સેંકડો બચાવ કર્મી લાપતા લોકોને શોધવામાં કાર્યરત છે. દેશના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પરનામબુકોની રાજધાની રિસીફ અને આસપાસના જબોઆતાઓ ડોસ ગ્વારરાપેસના વિસ્તારનું સોમવારે હવાઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. બાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે જમીન પર પરિસ્થિતિ એવી નથી કે હેલિકોપ્ટરને ઉતારી શકાય. બોલ્સોનારોએ કહ્યું કે આપત્તિમાં જાનહાનિ થવાથી તેઓ દુઃખી છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે



પેર્નમબુકોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે શુક્રવારે ભૂસ્ખલન થયું હતું. આનાથી પ્રાકૃતિક મુશ્કેલીઓથી ગ્રસ્ત પહાડીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. ક્ષેત્રીય વિકાસ મંત્રી ડેનિયલ ફેરરાએ કહ્યું કે સરકાર તે નગર પાલિકાઓને ફંડ આપવામાં કાર્યરત છે જેમણે કટોકટી જાહેર કરી છે.

## ચીનના સિયુઆન પ્રાંતમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ: ચારના મોત, 14 ઘાયલ

બૈજિંગ : ચીનના દક્ષિણપશ્ચિમના સિયુઆન પ્રાંતમાં યાન શહેરમાં આવેલા 6.1 તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું હતું. આ ભૂકંપમાં ચારના મોત થયા છે અને 14ને ઈજા થઈ છે, એમ શહેરના ભૂકંપ રાહત હેડક્વાર્ટરેથી જણાવાયું હતું. ચારના અર્થકવેક નેટવર્ક સેન્ટરના જણાવ્યા મુજબ સિયુઆન પ્રાંતના યાન શહેરમાં આવેલી લુશાન કાઉન્ટી સાંજે 5 વાગે આવેલા ભૂકંપના પગલે ધણધણી ઉઠી હતી. તેનું મુખ્ય કેન્દ્ર ત્યાંથી 17 કિ.મી. ઊંડાઈએ હતું. બુધવારે આવેલા ભૂકંપ પછી યાન શહેરની બાઓફિસંગ કાઉન્ટીમાં 8.5ની તીવ્રતાવાળો વધુ એક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં થયેલી જાનહાનિ બાઓફિસંગ કાઉન્ટીની છે.

## વાવાઝોડાથી આવેલા પૂર અને ભૂસ્ખલનથી ભારે નુકસાન મેક્સિકોમાં વાવાઝોડું 'અગાથા'થી 11 લોકોનાં મોત, જ્યારે 33 લાપતા

દક્ષિણ મેક્સિકોમાં વાવાઝોડા અગાથાને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે અને 33 લોકો લાપતા થયા છે તેમ દક્ષિણમાં આવેલા ઓક્સાકાના ગવર્નરે એક નિવેદનમાં જણાવ્યું છે. ઓક્સાકાના ગવર્નર એલેજાન્દ્રો મૂરાતે જણાવ્યું હતું કે પૂરને કારણે અનેક મકાનો તણાઈ ગયા છે. જ્યારે અનેક લોકો કીચડમાં અને કાટમાળમાં દબાયેલા છે. મૂરાતે સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે

લોકોનાં મોત પૂર અને ભૂસ્ખલનને કારણે થયા છે. તેમણે જણાવ્યું હતું કે મૃતકો પેકી મોટા ભાગનો લોકો પર્વતીય વિસ્તારોમાં આવેલા નાના શહેરોમાં હતાં. હુઆતુલ્કોના રિસોર્ટમાં ત્રણ બાળકો લાપતા થવાના પણ સમાચાર છે. અગાથા વાવાઝોડાને કારણે 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે આ વાવાઝોડું નબળું પડી ગયું છે અને હવે તે વેરાક્રૂઝ રાજ્યની તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

## અમેરિકા યુકેનને મીડિયમ રેન્જ રોકેટ સિસ્ટમ પૂરી પાડશે : જો બાઈડેન

યુકેનના પૂર્વ વિસ્તારમાં રશિયાના હુમલા ચાલુ રહ્યા છે તેવામાં અમેરિકાના પ્રમુખ જો બાઈડેને જાહેર કર્યું છે કે, અમેરિકા યુકેનની મદદ માટે વધુ પ્રબળ રોકેટ સિસ્ટમ મોકલશે. અહેવાલો જણાવે છે કે યુકેન આ માટે ઘણા સમયથી માગણી કરી રહ્યું હતું. જેથી શત્રુઓ ઉપર નિશ્ચિત રીતે હુમલા કરી શકાય. ફક્ત અમેરિકા જ નહીં યુરોપના દેશોએ પણ યુકેનને વધારે એડવાન્સ શસ્ત્રો પૂરા પાડવા હામી ભરી છે. જર્મનીએ જણાવ્યું હતું કે તે યુકેનને અત્યાધુનિક એન્ટિ ટેન્ક મિસાઈલ અને રાડાર સિસ્ટમ પૂરી પાડશે. યુએસ હાઈટેક મીડિયમ રેન્જ રોકેટ સિસ્ટમ્સ પૂરી પાડશે. બાયડેને જણાવ્યું હતું કે, આથી રશિયા સાથે મંત્રણા કરવામાં યુકેનની સ્થિતિ વધુ મજબૂત બનશે.

વીઝાતો વાયરો વેણુમાં વાયો, Method makes difference. (પદ્ધતિ તફાવત સર્જે છે)

# વિજયની વરમાળા પદ્ધતિની અપેક્ષા રાખે છે

ક્રિકેટ તો ગલીથી ગ્રાઉન્ડ સુધી ઘણા રમે છે, પણ જે પદ્ધતિસર રમે છે તે મેદાન મારી જાય છે. પરીક્ષામાં ઉત્તરવહી તો ઘણા ભરે છે, પણ જે પદ્ધતિસર લખે છે તેના ગળામાં સુવર્ણચંદ્રકો ઝૂલે છે. વ્યવસાય તો ઘણા કરે છે, પણ જે પદ્ધતિસર કરે છે તેના ઘેર ટેકશાળ ખૂલે છે. જી હા, વિજયની વરમાળા પદ્ધતિની અપેક્ષા રાખે છે અને પરાજયની હારમાળા અણઘડને વરે છે. આ હકીકત યુવા-ઘડતરની બાબતે સર્વત્ર દૃષ્ટિગોચર થાય છે. આજે દેશ અને દુનિયા યુવા પેઢીથી ઊભરાઈ રહ્યા હોવાને કારણે યુવાનીને યોગ્ય આકાર આપવા સૌ સજ્જ બન્યા છે. પરંતુ હજારો વ્યક્તિઓના લાખો પ્રયત્ન પછી સરવાળે શૂન્ય આવે છે ત્યારે ગ્રીક વિચારક પ્લેટોની જેમ સૌ નિસાસો નાંખી બેસે છે કે 'આજે આપણા યુવાનોનું શું થવા બેઠું છે ? તેઓ પોતાના વડીલોને માન આપતા નથી. મા-બાપની આમાન્યામાં રહેતા નથી. કાયદાની પરવાય કરતા નથી. તેઓ રસ્તે-ચોકે તોફાન કરે છે, બળવો પોકારે છે, દુનિયાને ઉથલાવવા નીકળ્યા છે. એમનામાં વિવેક નથી, ચારિત્ર્ય નથી, એમનું અને આપણું - હવે શું થશે ?'

આશરે 2300 વર્ષ પૂર્વેનો આ ઉચાટ અને ઉકળાટ આજે પણ પ્રસ્તુત છે, તો શું ચોવીસ-ચોવીસ સૈકાઓ વીતવા છતાં યુવા પેઢી બદલાઈ જ નથી ?

ના, સાવ એવું નથી. ઈતિહાસ સાક્ષી પૂરે છે કે, યુવાનીએ દુનિયાની દિશા અને દશા બદલ્યા છે. વડીલોની ભૂલનો ભોગ બનીને ભાંગી પડવાને આરે પહોંચેલા રઘુકુળને રામ, લક્ષ્મણ, ભરત, સીતા જેવી યુવાપેઢીએ ટકાવેલું તે પ્રાચીન ઈતિહાસ છે, તો સંસ્કૃતિનો શંખનાદ

ફૂંકનારા આચાર્ય શંકર કે સ્વામી વિવેકાનંદ એ યુવાશક્તિનું જ્વલંત પ્રતિક છે, જેણે ઈતિહાસ સર્જ્યા છે. ટૂંકમાં, યુવાની છેક વખોડવા લાયક તો નથી જ. પરંતુ તેનું ઘડતર યોગ્ય પદ્ધતિની અપેક્ષા રાખે છે. યુવા-ઘડતરની આવી એક અસરકારક પદ્ધતિ જણાવતાં ફાધર વાલેસે લખ્યું છે કે, 'રસ્તાની વચ્ચે એક ગુલાબનું ફૂલ પડેલું હતું. એ રસ્તે એક માણસ આવ્યો. એ ગુલાબ હાથમાં લીધું, હાથથી સાફ કર્યું, નાક સામે ધર્યું અને પ્રસન્નતાથી શ્વાસ લઈને, સુગંધ પીને અને રંગ માણીને, ગુલાબને હાથે પંખાળતો પંખાળતો એ આગળ ચાલતો રહ્યો. એના હાથમાં ગુલાબ ફરીથી જીવતું થયું. એ જ રીતે જીવનના રસ્તા પર પડેલા, કરમાયેલા, ખરડાયેલા યુવાન માટે જ્યારે કોઈ કદર કરનારો નીકળે, રંગ અને સુગંધ જાણનારો નીકળે, સારવાર કરનારો

આ રીતે યુવાનીના ખોળિયામાં જીવ મૂકી આપનારા હતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. તેનો સ્વાનુભવ વાગોળતાં ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રી રામલાલ પરીખે તા. ૬/૧૧/૧૯૮૮ના રોજ જણાવ્યું હતું કે, 'મારા શિક્ષણક્ષેત્રનાં પાંત્રીસ વર્ષના અનુભવ પરથી લાગે છે કે, અમે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેરી શકતા નથી. અહીં પ્રમુખસ્વામી મહારાજ પાસે આવીએ ત્યારે જોઈએ છીએ કે યુવાનો પોતાનો સમય, શક્તિ, હુન્નર, કુનેહ બધું સ્વામીજીને ચરણે સમર્પે છે. જે વિદ્યાર્થીઓ શાળાની ગંદકીમાં હાથ અડાડવાની ના પાડે છે, એ જ વિદ્યાર્થીઓ, એ જ યુવાશક્તિ અહીં સ્વામીજી પાસે પોતાનો પરસેવો રેડવા તૈયાર થાય છે. આ વસ્તુ બતાવે છે કે સુધારો કરવાનું ગજું સ્વામીજીએ જે રાહ બતાવ્યો તેમાં જ છે. એની

આ સમયે પ્રમુખસ્વામી મહારાજ પાસે આવી ચડેલા એક યુવાને પોતાના વાલી સામે જ બગાવતનું બ્યૂગલ ફૂંકી દીધેલું. અવળે રવાડે આથી રહેલા તેણે બેફિકરાઈથી સ્વામીને કહ્યું : 'હું આ રીતે આડો ફાટીશ તો જ મા-બાપની આંખ ઊઘડશે.'

'એવું થતું હશે ?'

'જો હું એવું ન કરું તો શું મૂંગે મોંએ અત્યાચાર સહન કરી લઉં ?'

આ સવાલના જવાબમાં સ્વીમી તેને કહે છે કે, 'તું સમજ. મા-બાપને શિક્ષા કરવાનો તારો અધિકાર શું ? મા-બાપની આંખ ઊઘડે તે માટે તું દાડૂ પીએ છે, પણ એમાં ખોટ કોને ? એમને સુધારવા માટે આપણે ખોટે રસ્તે ચઢાતું હશે ? આવા અવળા ઉપાયો કરવામાં તારું સમાજમાં સ્થાન શું ?'

આ પ્રશ્નાવલી દ્વારા ખુવારીનું ચિત્ર સ્પષ્ટ કરી આપી સ્વામીશ્રી બોલ્યા કે, 'મા-બાપનું જોનારા ભગવાન છે. એમને એ સુધારશે, પણ આવું બહારવટું કરવામાં તું દુઃખી થઈ જઈશ.'

સ્વામીજીની વાતમાં રહેલું હિત અને હેતુ પેલા ધૂંધવાતા યુવાનનું હેયું વીંધનારું નીવડ્યું. એ યુવક કુમાર્ગેથી પાછો વળવા કટિબદ્ધ થઈ ગયો. તે જોઈ સૌ વિચારી રહ્યા કે 'આ યુવાનના સાચા વાલી કોણ ?' પ્રમુખસ્વામી મહારાજ. તેઓ યુવાનોને ધુત્કારતા નહીં, ભલેને તે ભૂલ ભરેલા હોય. તેઓ યુવાનોને સ્નેહ આપતા, ભલેને તે અપરિચિત હોય. તેઓ યુવાનોમાં વિશ્વાસ રાખતા, ભલેને યુવાને પોતામાંથી વિશ્વાસ ગુમાવી દીધો હોય. પ્રમુખસ્વામી મહારાજની પદ્ધતિનું આ પંચામૃત જો વાલીઓ હસ્તગત કરે તો ઘેર ઘેર શ્રવણ અને નચિંકેતા પાડે.

મને દૈઘ પ્રતીતિ થઈ છે. આ પ્રતીતિનો એક પુરાવો તા. ૧૦/૭/૧૯૮૮ની સવારને સાંપડ્યો.



પ્રમુખસ્વામી મહારાજ યુવાનોને ધુત્કારતા નહીં, ભલેને તે ભૂલ ભરેલા હોય. તેઓ યુવાનોને સ્નેહ આપતા, ભલેને તે અપરિચિત હોય

# કોરોના બાદ વિશ્વમાં મન્કીપોક્સ વાયરસનો કહેર : અત્યાર સુધીમાં ૩૦૦થી વધારે કેસ

લંડન

વિશ્વમાં કોરોના વાઈરસ બાદ વધુ એક જીવલેણ વાઈરસ મન્કીપોક્સનો ડર જોવા મળી રહ્યો છે. ભારતમાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મંગળવારે એક ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મન્કીપોક્સના કેસના સર્વેલન્સ, ઓળખ અને મેનેજમેન્ટની વિગતો છે. અત્યાર સુધી વિશ્વમાં ૩૦૦થી વધુ મન્કીપોક્સ વાઈરસના કેસો જોવા મળ્યા છે.

જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના અનુસાર, કોરોના વાઈરસની માફક મન્કીપોક્સ પણ વૈશ્વિક મહામારી



નહીં બને. સંસ્થાએ તેને સંભવિત આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી ગણાવી છે. ઉપરાંત કોવિડ-૧૯ અને ઈબોલામાં જ પ્રકારે સતત રિસર્ચ અને રસીકરણની ઉપલબ્ધિ કરાવવામાં આવી રહી છે તે જ પ્રકારે આ

વાઈરસની દવાઓ અંગે હાલ રિસર્ચ કરવામાં આવી રહ્યા છે.

યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, મન્કીપોક્સ વાઈરસમાં દર્દી શરૂઆતમાં તાવ, માથાનો દુઃખાવો, મસલ્સ અને પીઠમાં દુઃખાવો, ઉપરાંત થાક અનુભવે છે. ચિકનપોક્સથી વિપરિત આ વાઈરસથી શરીરમાં જે લાલ ચકામા થાય છે તે આગળ જતાં ગાંઠમાં પરિવર્તિત થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના અનુસાર, સ્મોલપોક્સ કે ચિકનપોક્સને મન્કીપોક્સ સાથે સરખામણી ના કરવી જોઈએ.

# ફેસબુક કંપનીના COO શેરિલે સેન્ડબર્ગનું પદ પરથી રાજીનામું

ન્યૂયોર્ક

ફેસબુક અને તેની પેરન્ટ કંપની મેટા સાથે સંકળાયેલા એક મોટા અહેવાલ સામે આવ્યા છે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) શેરિલ સેન્ડબર્ગે પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ શેરિલે પદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલોને સમર્થન પણ આપ્યું હતું. જોકે શેરિલે હજી તેમણે પદત્યાગ કેમ કર્યો તેની સ્પષ્ટતા હજી નથી કરી.

સેન્ડબર્ગે રાજીનામાને મુકેલી ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે સામે ચાલીને સમાજ માટેના પરોપકારી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત

કરવાની યોજના બનાવી છે. સેન્ડબર્ગે ફેસબુકમાં લગભગ 14 વર્ષની સેવા આપી છે.

સેન્ડબર્ગે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, 'સોશિયલ મીડિયાને મુદ્દે થતી રહેતી ચર્ચા તેના આરંભિક દિવસોને મુકાબલે હાલમાં ખૂબ જ બદલાઈ ગઈ છે. તે બધા વિશે વાત કરવી મારા માટે હંમેશાં મુશ્કેલ રહ્યું છે. પરંતુ તે કામ મુશ્કેલ જ હોવું જોઈએ. અમારી પ્રોડક્ટ મોટા જનસમૂહને પ્રભાવિત કરે છે. તેથી અને તેને એ રીતે જ બનાવીશું કે જે લોકોની પ્રાઈવસી અને ગોપનીયતાનું રક્ષણ કરે અને તેમને સુરક્ષિત રાખે.'

# તુર્કીનું સત્તાવાર નામ બદલાઈને તુર્કીયે થયું, યુએનની માન્યતા મળી

તુર્કીય

તુર્કીની રેથેપ તૈયબ એર્દોઆનની સરકારે દેશનું સત્તાવાર નામ બદલી નાખ્યું છે. તુર્કી હવે તુર્કીયે નામથી ઓળખાશે. સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ તુર્કીના પ્રસ્તાવને માન્યતા આપી દીધી છે. અન્ય સંગઠનોને પણ તુર્કીએ નામ બદલવાની વિનંતી કરી છે. તુર્કી હવે સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ તુર્કીયે એવા નામથી ઓળખાશે. તુર્કીના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘને પત્ર લખીને સત્તાવાર રીતે તુર્કીયે નામનો ઉપયોગ કરવાની વિનંતી કરી છે. યુએને એ પ્રસ્તાવને માન્ય રાખીને તાત્કાલિક અસરથી સત્તાવાર નામ તુર્કીને બદલે તુર્કીયે કરી દીધું છે. હવેથી તમામ લેખિત અને સત્તાવાર દસ્તાવેજો કે નિવેદનોમાં તુર્કીયે નામ લખાશે-બોલાશે.

# બ્રાઝિલ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત બીજો દેશ બ્રાઝિલમાં ફરી કોરોના વાયરસનો આતંક, 24 કલાકમાં 63 લોકોના મોત

રિયો ડી જાનેરો

વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. મોટાભાગના દેશોમાં હજી પણ કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 63 મોત નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 6,66,516 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,082 નવા કોવિડ-19 કેસની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય

મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 30,977,661 થઈ ગઈ છે. જો કે, આ ડેટામાં ઉત્તરપૂર્વીય રાજ્ય પિયાઉનો સમાવેશ થતો નથી. તમને જણાવી દઈએ કે, બ્રાઝિલ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત બીજો દેશ છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બ્રાઝિલ પહેલા આવે છે. જ્યાં કોરોના વાયરસનો કહેર સૌથી વધુ જોવા મળ્યો છે. જ્યારે ભારત ત્રીજા નંબરે આવે છે. અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં કોરોના વાયરસના વધુ કેસ જોવા મળ્યા છે.

# અફઘાનિસ્તાનમાં અફીણ-હેરોઈનનું ઉત્પાદન બંધ કરવા તાલિબાનનો પ્રયાસ

કાબુલ

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે અફીણ હેરોઈન સહિતના નશીલા પદાર્થોનું ઉત્પાદન બંધ થાય તે માટે મોટાપાયે પ્રયાસો શરૂ કર્યા છે. અફઘાનિસ્તાનના ખેડૂતો વર્ષોથી અફીણની ખેતી કરે છે. અફીણની ખેતી બંધ થશે તો અસંખ્ય ખેડૂતો ગરીબીમાં ધકેલાશે તેવી દહેશત પણ વ્યક્ત થઈ છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે નશીલા પદાર્થોનું ઉત્પાદન ઘટે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં ૧.૮ અબજ ડોલરથી ૨.૭ અબજ ડોલરના નશીલા પદાર્થોનું ઉત્પાદન થયું હતું. અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી મોટાપાયે થાય છે. અફઘાનિસ્તાનના જીડીપીમાં નશીલા પદાર્થોના ઉત્પાદનનો હિસ્સો ૧૪ ટકા જેટલો ઊંચો છે.


**Porcelain Tiles : Premium Quality and Best Price**

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking


**TILES • BACKSPLASH • LAMINATE • VINYL • HARDWOOD**
**MONTREAL**

 3590, Rue Griffith, Saint Laurent,  
 QC, H4T 1A7  
 Phone: +1-514-260-2242 /  
 +1-514-813-3850

**OTTAWA**

 Unit #4+5, 200  
 Colonnade Road,  
 Nepean, ON, K2E 7M1  
 +1-613-601-1474

**MISSISSUAGA**

 5030 Maingate Drive, Unit#1,  
 Mississauga, L4W 1X5  
 Phone: +1 (647) 527-6030 /  
 +1-514-813-3850

**CAMBRIDGE**

 15 Sheldon Dr, Cambridge,  
 ON N1R 6R8  
 +1-647-542-1508,  
 +1-647-527-6030

<https://clubceramic.com> Email : sales@clubceramic.com